



(Qaume Loot Ki Tabah Kariyan Gujarati)

કૌમે લૂત કી તબાહ કારિયાં

- પથ્થર ને પીછા કિયા !
- ખૌફનાક સાંપ કી ઝબ
- સુલગતી લાશે
- શહવત સે બચને કે 12 મ-દની ફૂલ
- કૌમે લૂત કે કબ્રિસ્તાન મેં
- નામ રખને કે બારે મેં 18 મ-દની ફૂલ
- પેશ ઈમામ કી કરામત

શૈબે તરીકત, અમીરે અહલે સુન્નાત, બ્રાહિમે દા'વતે ઠરલામી, હઝરત અલ્લામા મૌલાના અબૂ ઝિલાલ

મુહમ્મદ ઇલ્યાસ અતાર કાદિરી ૨-ઝવી

استاد کاظم العالی

الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْمُرْسَلِينَ
أَمَّا بَعْدُ فَأَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ

કિતાબ પઢને કી દુઆ

અઝ : શૈખે તરીકત, અમીરે અહલે સુન્નત, બાનિયે દા'વતે ઇસ્લામી, હઝરત અલ્લામા મૌલાના અબૂ બિલાલ મુહમ્મદ ઇલ્યાસ અત્તાર કાદિરી ર-ઝવી دَامَتْ بَرَكَاتُهُمُ الْعَالِيَةِ દીની કિતાબ યા ઇસ્લામી સબક પઢને સે પહલે ઝૈલ મેં દી હુઈ દુઆ પઢ લીજિયે إِنْ شَاءَ اللَّهُ عَزَّ وَجَلَّ જો કુછ પઢેગે યાદ રહેગા. દુઆ યેહ હૈ :

اللَّهُمَّ افْتَحْ عَلَيْنَا حِكْمَتَكَ وَأَنْشُرْ
عَلَيْنَا رَحْمَتَكَ يَا دَا الْجَلَالِ وَالْإِكْرَامِ

તરજમા : ઐ અલ્લાહ જલ્ જલ્ ! હમ પર ઇલ્મ વ હિક્મત કે દરવાઝે ખોલ દે ઔર હમ પર અપની રહમત નાઝિલ કરમા ! ઐ અ-ઝમત ઔર બુરુગી વાલે ! (المستطرف ج ١ ص ١٤٨ دار الفكر بيروت)
નોટ : અવ્વલ આખિર એક એક બાર દુરુદ શરીફ પઢ લીજિયે.

તાલિબે ગમે મદીના

વ બકીઅ

વ મગિફરત

13 શવાલુલ મુકર્રમ 1428 હિ.



કિયામત કે રોઝ હસરત

इरमाने मुस्तफ़ा صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ : सभ से जियादा हसरत

કિયામત કે દિન ઉસ કો હોગી જિસે દુન્યા મેં ઇલ્મ હાસિલ કરને કા મૌકઅ મિલા મગર ઉસ ને હાસિલ ન કિયા ઔર ઉસ શખ્સ કો હોગી જિસ ને ઇલ્મ હાસિલ કિયા ઔર દૂસરોં ને તો ઉસ સે સુન કર નફૂઅ ઉઠાયા લેકિન ઉસ ને ન ઉઠાયા (યા'ની ઉસ ઇલ્મ પર અમલ ન કિયા)

(تاريخ دمشق لابن عسكروج ٥١ ص ١٣٨ دار الفكر بيروت)

કિતાબ કે ખરીદાર મુ-તવજ્જેહ હોં

કિતાબ કી તબાઅત મેં નુમાયા ખરાબી હો યા સફહાત કમ હોં યા બાઈન્ડિંગ મેં આગે પીછે હો ગએ હોં તો મક-ત-બતુલ મદીના સે રુજૂઅ ફરમાઈયે.

“કૌમે લૂત કી તબાહ કારિયાં”

યેહ રિસાલા (કૌમે લૂત કી તબાહ કારિયાં)

શૈખે તરીકત, અમીરે અહલે સુન્નત, બાનિયે દા'વતે ઇસ્લામી હઝરત અલ્લામા મૌલાના અબૂ બિલાલ મુહમ્મદ ઇલ્યાસ અત્તાર કાદિરી ર-ઝવી ઝિયાઈ **رحمۃ اللہ علیہ** نے ઉર્દૂ ઝબાન મેં તહરીર ફરમાયા હૈ.

મજલિસે તરાજિમ (દા'વતે ઇસ્લામી) ને ઇસ રિસાલે કો ગુજરાતી રસ્મુલ ખત મેં તરતીબ દે કર પેશ કિયા હૈ ઓર મક-ત-બતુલ મદીના સે શાએઅ કરવાયા હૈ. ઇસ મેં અગર કિસી જગહ કમી બેશી પારોં તો મજલિસે તરાજિમ કો (બ ઝરીઅએ મક્તૂબ, ઇ-મેઇલ યા SMS) મુત્તલઅ ફરમા કર સવાબ કમાઈયે.

રાબિતા : મજલિસે તરાજિમ (દા'વતે ઇસ્લામી)

મક-ત-બતુલ મદીના

સિલેક્ટેડ હાઉસ, અલિફ કી મસ્જિદ કે સામને, તીન દરવાઝા,

અહમદઆબાદ-1, ગુજરાત, ઇન્ડિયા

MO. 09374031409

E-mail : translationmaktabhind@dawateislami.net

الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْمُرْسَلِينَ
مَا بَعُدُ فَأَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ

કૌમે લૂત કી તબાહ કારિયાં¹

શૈતાન લાખ સુસ્તી દિલાએ યેહ બયાન (48 સફહાત) આખિર તક
પઠ લીજિયે إِنَّ شَاءَ اللَّهُ عَزَّوَجَلَّ આપ ખૌકે આખિરત સે લરઝ ઉઠેંગે.

દુરૂદ શરીફ કી ફઝીલત

અલ્લાહ ઈઝ્જલ્ ઈઝ્જલ્ કે મહબૂબ, દાનાએ ગુયૂબ, મુનઝ્ઝહુન અનિલ
ઉયૂબ صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ કા ફરમાને તકરુબ નિશાન હૈ : બેશક
બરોઝે કિયામત લોગોં મેં સે મેરે કરીબ તર વોહ હોગા જો મુઝ પર સબ
સે ઝિયાદા દુરૂદ ભેજે. (તૈરમ્ઝી જ ૨ વ ૨૭ હદિથ ૬૪૬)

صَلُّوْا عَلَيَّ الْحَبِيْب! صَلَّى اللهُ تَعَالَى عَلَيَّ مُحَمَّد

ઇબ્રાહીમ ખલીલુલ્લાહ કે ભતીજે

હઝરતે સય્યિદુના લૂત عَلَيْهِ الصَّلَاةُ وَالسَّلَام

1 : યેહ બયાન અમીરે અહલે સુન્નત دَامَتْ بَرَكَاتُهُمُ الْعَالِيَةِ ને તબ્લીગે કુરઆનો સુન્નત કી
આલમગીર ગૈર સિયાસી તહરીક દા'વતે ઈસ્લામી કે આલમી મ-દની મર્કઝ ફૈઝાને
મદીના કે અન્દર હફતાવાર સુન્નતોં ભરે ઈજતિમાઅ (29 ઝી કા'દહ 1432 સિ.હિ./
27-10-11) મેં ફરમાયા થા. તરમીમ વ ઈઝાફે કે સાથ તહરીરન હાઝિરે ખિદમત હૈ.

-મજલિસે મક-ત-બતુલ મદીના

કરમાને મુસ્તક : صلى الله تعالى عليه وآله وسلم | જો શબ્દ મુઝ પર દુરુદ પાક પઢના ભૂલ ગયા વોહ જન્ત કો રોસ્તા ભૂલ ગયા. (બ્રાન)

ઈબ્રાહીમ **عَلَى نَبِيِّنا وَعَلَيْهِ الصَّلَاةُ وَالسَّلَام** કે ભત્તીજે હૈ, આપ **عَلَى نَبِيِّنا وَعَلَيْهِ الصَّلَاةُ وَالسَّلَام** સદૂમ કે નબી થો. ઓર આપ **عَلَى نَبِيِّنا وَعَلَيْهِ الصَّلَاةُ وَالسَّلَام** હઝરતે સચ્ચિદુના ઈબ્રાહીમ ખલીલુલ્લાહ **عَلَى نَبِيِّنا وَعَلَيْهِ الصَّلَاةُ وَالسَّلَام** કે સાથ હિજરત કર કે મુલ્કે શામ મેં આએ થે ઓર હઝરતે સચ્ચિદુના ઈબ્રાહીમ ખલીલુલ્લાહ **عَلَى نَبِيِّنا وَعَلَيْهِ الصَّلَاةُ وَالسَّلَام** કી બહુત ખિદમત કી થી. હઝરતે સચ્ચિદુના ઈબ્રાહીમ **عَلَى نَبِيِّنا وَعَلَيْهِ الصَّلَاةُ وَالسَّلَام** કી દુઆ સે આપ નબી બનાએ ગએ.

(નૂરુલ ઈરફાન, સ. 255)

દુન્યા મેં સબ સે પહલે શૈતાન ને બદ ફે'લી કરવાઈ

દુન્યા મેં સબ સે પહલે બદ ફે'લી શૈતાન ને કરવાઈ, વોહ હઝરતે સચ્ચિદુના લૂત **عَلَى نَبِيِّنا وَعَلَيْهِ الصَّلَاةُ وَالسَّلَام** કી કૌમ મેં અમરદે હસીન યા'ની ખૂબ સૂરત લડકે કી શકલ મેં આયા ઓર ઉન લોગોં કો અપની જાનિબ માઈલ ક્રિયા યહાં તક કે ગન્દા કામ કરવાને મેં કામ્યાબ હો ગયા ઓર ઈસ કા ઉન કો ઐસા ચસ્કા લગા કે ઈસ બુરે કામ કે આદી હો ગએ ઓર નૌબત યહાં તક પહોંચી કે ઓરતોં કો છોડ કર મદોં સે અપની “ખ્વાહિશ” પૂરી કરને લગે. (ماخوذ از مُكَاشَفَةُ الْقُلُوبِ ص ٧٦)

સચ્ચિદુના લૂત **عَلَى نَبِيِّنا وَعَلَيْهِ الصَّلَاةُ وَالسَّلَام** ને સમઝાયા

હઝરતે સચ્ચિદુના લૂત **عَلَى نَبِيِّنا وَعَلَيْهِ الصَّلَاةُ وَالسَّلَام** ને ઉન લોગોં કો ઈસ ફે'લે બદ સે મન્ઝ કરતે હુએ જો બયાન ફરમાયા ઈસ કો પારહ 8 સૂ-રતુલ આ'રાફ આયત નમ્બર 80 ઓર 81 મેં ઈન અલ્ફાઝ મેં ઝિક્ર ક્રિયા ગયા હૈ :

करमाने मुस्तक़ा : على الله تعالى عليه وآله وسلم जिस के पास मेरा जिक्र हुआ और उस ने मुझ पर दुर्इद पाक न पढा तबकीक वोह
बदबप्त हो गया. (17)

أَتَأْتُونَ الْفَاحِشَةَ مَا سَبَقَكُمْ بِهَا مِنْ
أَحَدٍ مِنَ الْعَالَمِينَ ﴿٨﴾ إِنَّكُمْ لَتَأْتُونَ
الرِّجَالَ شَهْوَةً مِنْ دُونِ الْنِسَاءِ ۗ
بَلْ أَنْتُمْ قَوْمٌ مُّسْرِفُونَ ﴿٩﴾

तर-ज-मअे कन्जुल ईमान : क्या
वोह बे हयाई करते हो ज़ो तुम से
पहले जहान में किसी ने न की.
तुम तो मर्दों के पास शह्वत से ज़ाते
हो औरतें छोड कर, बडे तुम लोग
हद से गुज़र गअे.

हउरते सय्यिहुना लूत क्के दुन्या व
आभिरत की तबलई पर मुशतमिल बयाने आइय्यत निशान को
सुन कर बे हया कौम ने बजअे सरे तरलीम भम करने के ज़ो बे
बाकाना जवाब दिया उसे पारह 8 सू-रतुल आ'राइ आयत 82 में
ईन लइजों के साथ बयान किया गया है :

وَمَا كَانَ جَوَابَ قَوْمِهِ إِلَّا أَنْ
قَالُوا أَخْرِجُوهُمْ مِنْ قَرْيَتِكُمْ ۗ
إِنَّهُمْ أَنْفُسٌ يَّطْهَرُونَ ﴿١٣﴾

तर-ज-मअे कन्जुल ईमान : और
उस की कौम का कुछ जवाब न था
मगर येही कहना के ईन को अपनी
बस्ती से निकाल दो येह लोग तो
पाकीजगी याहते हैं.

कौमे लूत पर लरजा भैज अजाब नाजिल हो गया

जब कौमे लूत की सरकशी और भरलते बह ई'ली काबिले
हिदायत न रही तो अद्लाह तआला का अजाब आ गया, युनान्ये
हउरते सय्यिहुना जिब्रील عَلَيْهِ الصَّلَاةُ وَالسَّلَام यन्द इरिशतों के हमराह
अमरदे हसीन या'नी भूब सूरत लउकों की सूरत में मेहमान बन
कर हउरते सय्यिहुना लूत क्के दुन्या व क्के पास पड़ोंये .
उन मेहमानों के हुस्नो जमाल और कौम की बहकारी की भरलत

ફરમાને મુસ્તફા ﷺ : طى الله تعالى عليه واله وسلم : जिस ने मुझ पर दस मरतबा सुबह और दस मरतबा शाम दुःखे पाक पढा।
(उसे कियामत के दिन मेरी शफ़ाअत मिलेगी। (عنه)

કે ખયાલ સે હઝરતે સય્યિદુના લૂત عَلَيْهِ الصَّلَاةُ وَالسَّلَام નિહાયત મુશવ્વશ યા'ની ફિક મન્દ હુએ. થોડી દેર બા'દ કૌમ કે બદ ફે'લોં ને હઝરતે સય્યિદુના લૂત عَلَيْهِ الصَّلَاةُ وَالسَّلَام કે મકાને આલીશાન કા મુહા-સરા કર લિયા ઓર ઉન મેહમાનોં કે સાથ બદ ફે'લી કે બુરે ઈરાદે સે દીવાર પર ચઢને લગે. હઝરતે સય્યિદુના લૂત عَلَيْهِ الصَّلَاةُ وَالسَّلَام ને નિહાયત દિલસોઝી કે સાથ ઉન લોગોં કો સમઝાયા મગર વોહ અપને બદ ઈરાદે સે બાઝ ન આએ. આપ عَلَيْهِ الصَّلَاةُ وَالسَّلَام કો મુ-તફકિર વ રન્જદા દેખ કર હઝરતે સય્યિદુના જિબ્રીલ عَلَيْهِ الصَّلَاةُ وَالسَّلَام ને કહા : يا نبىءكلام الله ! आप गमगीन न हों, हम फिरिश्ते हैं और इन बद्कारों पर अब्लाह عَزَّوَجَلَّ का अजाब ले कर उतरे हैं, आप मुअमिनीन और अपने अह्लो ઈયાલ કો સાથ લે કર સુબહ હોને સે પહલે પહલે ઈસ બસ્તી સે દૂર નિકલ જાઈયે ઓર ખબરદાર ! કોઈ શખ્સ પીછે મુઝ કર બસ્તી કી તરફ ન દેખે વરના વોહ ભી ઈસ અઝાબ મેં ગરિફતાર હો જાએગા. યુનાન્યે હઝરતે સય્યિદુના લૂત عَلَيْهِ الصَّلَاةُ وَالسَّلَام અપને ઘર વાલોં ઓર મોમિનોં કો હમરાહ લે કર બસ્તી સે બાહર તશરીફ લે ગએ. ફિર હઝરતે સય્યિદુના જિબ્રીલ عَلَيْهِ الصَّلَاةُ وَالસَّلَام ઈસ શહર કી પાંચોં બસ્તિયોં કો અપને પરોં પર ઉઠા કર આસ્માન કી તરફ બુલન્દ હુએ ઓર કુદ્ર ઊપર જા કર ઉન બસ્તિયોં કો ઝમીન પર ઉલટ દિયા. ફિર ઉન પર ઈસ ઝોર સે પથ્થરોં કા મીંહ બરસા કે કૌમે લૂત કી લાશોં કે ભી પરખ્યે ઉઝ ગએ ! એન ઉસ વક્ત જબ કે યેહ શહર ઉલટ પલટ હો રહા થા હઝરતે સય્યિદુના લૂત عَلَيْهِ الصَّلَاةُ وَالસَّلَام કી એક બીવી જિસ કા નામ “વાઈલા” થા જો કે દર હકીકત મુનાફિકા થી ઓર કૌમ કે બદાકારોં સે મહબ્બત રખતી થી ઉસ ને

કરમાન મુસ્તફા ﷺ صلی اللہ تعالیٰ علیہ وآلہ وسلم : જા મુઝ પરે રોઝ જુમુઆ દુરૂદ શરીફ પઢગા મે કિયામત ક દિન ઉસે કી શકાઅત કરુંગા. (ક્રમ્હાલ)

સુઅર ઇગ્લામ બાઝ હોતા હૈ

મુફસ્સિરે શહીર હકીમુલ ઉમ્મત હઝરતે મુફતી અહમદ યાર ખાન عليه زحمة الحنَّان ફરમાતે હૈં : ફાહિશા (બે હયાઈ) વોહ ગુનાહ હૈ જિસે અક્લ ભી બુરા સમઝે. કુફ અગર્યે બદ તરીન ગુનાહે કબીરા હૈ મગર ઇસે રબ (عَزَّوَجَلَّ) ને ફાહિશા (યા'ની બે હયાઈ) ન ફરમાયા ક્યૂંકે નફસે ઇન્સાની ઇસ સે ઘિન નહીં કરતી. બહુતેરે આકિલ (અક્લ મન્દ કહલાને વાલે) ઇસ મેં ગરિફતાર હૈં મગર ઇગ્લામ (યા'ની બદ ફે'લી) તો ઐસી બુરી ચીઝ હૈ કે જાનવર ભી ઇસ સે મુ-તનફિફર હૈં સિવાએ સુઅર કે. લડકોં સે ઇગ્લામ હરામે કલ્થ હૈ ઇસ કે હરામ હોને કા મુન્કિર (યા'ની ઇન્કાર કરને વાલા) કાફિર હૈ. લૂતી (યા'ની ઇગ્લામ બાઝ) મર્દ, “ઔરત” કે કાબિલ નહીં રહતા.

(નૂરુલ ઇરફાન, સ. 255)

અલ્લાહ عزَّوَجَلَّ કી બારગાહ મેં સબ સે ઝિયાદા ના પસન્દીદા ગુનાહ

હઝરતે સય્યિદુના સુલૈમાન عليه الصَّلوة وَالسَّلَام ને એક મર્તબા શૈતાન સે પૂછા કે અલ્લાહ عزَّوَجَلَّ કો સબ સે બઢ કર કૌન સા ગુનાહ ના પસન્દ હૈ? ઇબ્લીસ બોલા : અલ્લાહ તઆલા કો યેહ ગુનાહ સબ સે ઝિયાદા ના પસન્દ હૈ કે મર્દ, મર્દ સે બદ ફે'લી કરે ઔર ઔરત, ઔરત સે અપની ખ્વાહિશ પૂરી કરે. (روحُ البیان ج ۳ ص ۱۹۷) ખા-તમુલ મુર-સલીન, રહ્મતુલ્લિલ આ-લમીન صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ કા ફરમાને ઇબ્રત નિશાન હૈ : જબ મર્દ મર્દ સે હરામ કારી કરે તો વોહ દોનોં ઝાની હૈં ઔર જબ ઔરત ઔરત સે હરામ કારી કરે તો વોહ દોનોં ઝાનિયા હૈં.

(السَّننُ الكُبْرَى ج ۸ ص ۴۰۶ حدیث ۱۷۰۳۳)

ફરમાને મુસ્તફા صَلَّی اللہُ تَعَالٰی عَلَیْہِ وَاٰلِہٖ وَسَلَّم : મુઝ પર દુરૂદે પાક કી કસરત કરો બેશક યેહ તુમ્હારે લિયે તહારત હૈ. (બ્રહ્મ)

ત્રીન તરહ કે અમ્રદ પરસ્ત

હઝરતે સચ્ચિદ્દના અબૂ સઈદ ખુદરી رَضِيَ اللهُ تَعَالَى عَنْهُ سے મરવી હૈ કે આખિરી ઝમાને મેં કુછ લોગ “લૂતિયા” કહલાઝેંગે ઓર યેહ ત્રીન³ તરહ કે હોંગે ﴿1﴾ વોહ કે જો (શહ્વત કે સાથ) સિફ અમ્રદોં કી સૂરતેં દેખેંગે ઓર (બા વુજૂદે શહ્વત) ઉન સે બાતચીત કરેંગે ﴿2﴾ જો (શહ્વત કે સાથ) ઉન સે હાથ મિલાઝેંગે ઓર ગલે ભી મિલેંગે ﴿3﴾ જો ઉન કે સાથ બદ ફે'લી કરેંગે. ઉન સભોં પર અલ્લાહ عَزَّوَجَلَّ કી લા'નત હૈ મગર વોહ જો તૌબા કર લેંગે. (તો અલ્લાહ عَزَّوَجَلَّ ઉન કી તૌબા કબૂલ ફરમા લેગા ઓર વોહ લા'નત સે બચે રહેંગે)

(الْفَرْدُوسُ بِمَأْثُورِ الْخَطَّابِ ج ۲ ص ۳۱۰ حَدِيث ۳۴۲۰)

સુલગતી લાશે

હઝરતે સચ્ચિદ્દના ઈસા રહુલ્લાહ الصَّلَاةُ وَالسَّلَامُ عَلٰی نَبِيِّنَا وَعَلَيْهِ الصَّلَاةُ وَالسَّلَامُ ને એક બાર જંગલ મેં દેખા કે એક “મર્દ” પર આગ જલ રહી હૈ. આપ الصَّلَاةُ وَالسَّلَامُ عَلٰی نَبِيِّنَا وَعَلَيْهِ الصَّلَاةُ وَالسَّلَامُ ને પાની લે કર આગ બુઝાની ચાહી તો આગ ને અમ્રદ કી સૂરત ઈખ્તિયાર કર લી. હઝરતે સચ્ચિદ્દના ઈસા રહુલ્લાહ الصَّلَاةُ وَالسَّلَامُ عَلٰی نَبِيِّنَا وَعَلَيْهِ الصَّلَاةُ وَالسَّلَامُ ને અલ્લાહ عَزَّوَجَلَّ કી બારગાહ મેં અર્ઝ કી : યા અલ્લાહ عَزَّوَجَلَّ ! ઈન દોનોં કો અપની અસ્લી હાલત પર લૌટા દે, તા કે મેં ઈન સે ઈન કા ગુનાહ પૂછું. યુનાન્થે મર્દ ઓર અમ્રદ આગ સે બાહર આ ગએ. મર્દ કહને લગા : યા રહુલ્લાહ الصَّلَاةُ وَالسَّلَامُ عَلٰی نَبِيِّنَا وَعَلَيْهِ الصَّلَاةُ وَالسَّلَامُ ! મેં ને ઈસ અમ્રદ સે દોસ્તી કી થી, અફ્સોસ ! શહ્વત સે મગ્લૂબ હો કર મેં ને શબે જુમુઆ ઈસ સે બદ ફે'લી કી, દૂસરે દિન ભી કાલા મુંહ ક્રિયા. એક નાસેહ (યા'ની નસીહત કરને વાલે) ને ખુદા عَزَّوَجَلَّ

करमान मुस्तकः على الله تعالى عليه وآله وسلم : तुम जहां भी हो मुज पर दुरेद पढो क तुम्हारा दुरेद मुज तक
पहोंयता है. (परान)

का षौड़ दिलाया मगर में न माना. फिर हम दोनों मर गये. अब
बारी बारी आग बन कर अक दूसरे को जलाते हैं और हमारा येह
अजाब क्रियामत तक है. اَلْعِيَاذُ بِاللّٰهِ تَعَالٰی (या'नी अद्लाह तआला की
पनाह)

(نُزْهُةُ الْمَجَالِسِ ج ٢ ص ٥٢)

अमरद भी जहन्नम का हकदार !

अमरदों से दोस्तियां करने वाले शैतान के वार से अबरदार !
बेशक इब्तिदाअन निखत साइ ही सही, मगर शैतान को बहकाते
देर नहीं लगती, अमरद से दोस्ती करने वाले का कुछ नहीं तो बह
निगाही और शह्वत के साथ बहन टकराने के गुनाह से बचना तो
निहायत ही दुश्वार होता है. येह भी याद रहे ! अगर अमरद
रिजा मन्दी से या पैसों या नोकरी वगैरा के लालच में बह डे'ली
करवायेगा तो वोह भी गुनहगार और जहन्नम का हकदार है.

कौमे लूत के कब्रिस्तान में

उज्जरते सय्यिदुना वकीअ رَضِيَ اللهُ تَعَالَى عَنْهُ से मरवी है : “जो
शप्स कौमे लूत का सा अमल (या'नी बह डे'ली) करता होगा और
बिगैर तौबा मरेगा, तो तदईन के बा'द उसे कौमे लूत के कब्रिस्तान
में मुन्ताकिल कर दिया जायेगा और उस का हशर कौमे लूत के साथ
होगा.” (या'नी कौमे लूत के साथ क्रियामत में उठेगा)

(ابن عَسَاكِر ج ٤ ص ٤٠٦)

धग्लाम बाज की दुज्या में सजा

उ-नई मजहब में धग्लाम बाज (या'नी बह डे'ली करने
वाले) की सजा येह है के उस के उपर दीवार गिरा दें या ठिंथी

કરમાને મુસ્તકા : صلى الله تعالى عليه وآله وسلم : जिस के पास मेरा जिक्र हो और वोह मुज पर दुःख शरीक न पड़े तो वोह लोगों में से कन्जूस तरीन शप्स है. (زينة)

જગહ સે ઉસ કો ઔઠા કર કે ગિરાએં ઔર ઉસ પર પથ્થર બરસાએં યા ઉસે કેદ મેં રખેં યહાં તક કે મર જાએ યા તૌબા કર લે. યા ચન્દ બાર યેહ ફે'લે બદ ક્રિયા હો તો બાદશાહે ઇસ્લામ ઉસે કત્લ કર ડાલે. (દરમુખ્તારુ રુદા'લમુખ્તાર જ ૧ વ ૬૬, ૬૩) અવામ કે લિયે ઇજાઝત નહીં કે બયાન કર્દા સઝાએં દેં, સિફ હાકિમે ઇસ્લામ દેગા.

બદ ફે'લી કો જાઘઝ સમઝના કેસા ?

દા'વતે ઇસ્લામી કે ઇશાઅતી ઇદારે મક-ત-બતુલ મદીના કી મતબૂઆ 692 સફહાત પર મુશ્તમિલ કિતાબ, “કુફિયા કલિમાત કે બારે મેં સુવાલ જવાબ” સફહા 397 તા 398 સે દો સુવાલ જવાબ મુલા-હઝા ફરમાઈયે :

સુવાલ : જો બદ ફે'લી કો જાઈઝ સમઝે યા જાઈઝ કહે ક્યા વોહ મુસલ્માન હી રહેગા ?

જવાબ : નહીં, વોહ કાફિર હો જાએગા. ફુ-કહાએ કિરામ رَحْمَةُ اللهِ السَّلَام کيرامته هُيَ : जिस ने हरामे ईजमाई की छुरमत का ईन्कार किया या उस के हराम होने में शक किया वोह काफिर है जैसे शराब (ખમ્ર), ઝિના, લિવાતત, સૂદ વગેરહા.

(مَنْحُ الرُّوضِ ص ۵۰۳)

મેરે આકા આ'લા હઝરત, ઇમામે અહલે સુન્નાત, મૌલાના શાહ ઇમામ અહમદ રઝા ખાન عَلَيْهِ رَحْمَةُ الرَّحْمٰن لિવાતત કે હલાલ હોને કે કાઈલ કે બારે મેં ઇશાદિ ફરમાતે હેં હિલ્લે લિવાતત કા કાઈલ કાફિર હે. (ફતાવા ર-ઝવિયા, જિ. 23, સ. 694)

“કાશ ! બદ ફે'લી જાઘઝ હોતી” કહના કુફ હે

સુવાલ : ઉસ શપ્સ કે લિયે ક્યા હુકમ હે જો જાઈઝ તો ન કહે મગર યેહ

ફરમાને મુસ્તકા : صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ : उस शप्स की नाक पाक आवूँद हो जिस के पास मेरा जिक्र हो और वह मुज पर दुइदे पाक न पड़े. (फ़)

તમન્ના કરે કે કાશ ! બદ ફે'લી જાઈઝ હોતી.

જવાબ : યેહ તમન્ના ભી કુફ હૈ. અલ બહુરુરૈઈક જિલ્દ 5 સફહા 208 પર હૈ : જો હરામ કામ કભી હલાલ ન હુએ ઉન કે બારે મેં હલાલ હોને કી તમન્ના કરના કુફ હૈ મ-સલન તમન્ના કરના કે કાશ ! ઝુલ્મ, ઝિના ઓર કત્લે નાહક હલાલ હોતે.

પેશ ઇમામ કી ફરામત

ઐ અલ્લાહ કી રહમત સે જન્નતુલ ફિરદૌસ મેં મક્કી મ-દની આકા صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ કે પડોસ કે તલબ ગારો ! બદ ફે'લી સે બચને કે લિયે નિગાહોં કી હિફાઝત ભી ઝરૂરી હૈ કે યેહ ઇસ ખૌફનાક ગુનાહ કી પહલી સીઠી હૈ, બદ નિગાહી કી તબાહ કારી કી એક ઝલક મુલા-હઝા હો, યુનાન્યે હાફિઝ અબૂ અમ્ર મદ્રસે મેં કુરઆને પાક પઢાતે થે, એક બાર એક ખૂબ સૂરત લડકા પઢને કે લિયે આ ગયા, ઉસ કી તરફ ગન્દી લઝઝત કે સાથ દેખતે હી ઉન કો સારા કુરઆન શરીફ ભુલા દિયા ગયા, ખૂબ તૌબા કી ઓર રોતે હુએ મશહૂર તાબેઈ બુઝુર્ગ હઝરતે સય્યિદુના હસન બસરી عَلَيْهِ رَحْمَةُ اللهِ الْكُوفِي کی બારગાહ મેં હાઝિર હો કર રૂદાદ અર્ઝ કર કે તાલિબે દુઆ હુએ. ફરમાયા : ઇસી સાલ હજ કી સઆદત હાસિલ કરો ઓર મિના શરીફ કી મસ્જિદુલ ખૈફ શરીફ મેં જા કર વહાં પેશ ઇમામ સે દુઆ કરવાઓ. યુનાન્યે (સાબિકા) હાફિઝ સાહિબ ને હજ કિયા ઓર મસ્જિદુલ ખૈફ શરીફ મેં ઝોહર સે પહલે હાઝિર હો ગએ, એક નૂરાની ચેહરે વાલે બૂઢે પેશ ઇમામ સાહિબ લોગોં કે ઝુરમટ કે અન્દર મેહરાબ મેં તશરીફ ફરમા થે. કુછ દેર કે બા'દ એક સાહિબ તશરીફ લાએ,

ફરમાને મુસ્તકા : عَلَى اللَّهِ تَعَالَى عَلَيْهِ وَالْوَسْمُ : जिस ने मुझ पर रोजे जुमुआ दो सो बार दुरदे पाक पढा उस के दो सो साल के गुनाह मुआफ़ छोणे. (क्रमल)

બ શુમૂલ ઈમામ સાહિબ સબ ને ખડે હો કર ઉન કા ઈસ્તિકબાલ ક્રિયા, નૌ વારિદ (નએ આને વાલે સાહિબ) ભી ઉસી હલકે મેં બૈઠ ગએ. અઝાન હુઈ ઔર નમાઝે ઝોહર કે બા'દ લોગ મુન્તશિર હો ગએ. પેશ ઈમામ સાહિબ કો તન્હા પા કર (સાબિકા) હાફિઝ સાહિબ આગે બઢે ઔર સલામ વ દસ્ત બોસી કે બા'દ રોતે હુએ મુદઆ અઝ કર કે દુઆ કી ઈસ્તિજા કી, પેશ ઈમામ સાહિબ કે દુઆ કરતે હી સારા કુરઆને મજ્હદ ફિર હિફઝ હો ગયા, ઈમામ સાહિબ ને પૂછા : તુમ્હેં મેરા પતા કિસ ને બતાયા ? અઝ કી : હઝરતે સય્યિદુના હસન બસરી عَلَيْهِ رَحْمَةُ اللَّهِ الْقَوِي ને. ફરમાને લગે : અચ્છા ! ઉન્હોં ને મેરા પદા ફાશ ક્રિયા હૈ, અબ મેં ભી ઉન કા રાઝ ખોલતા હૂં, સુન્નો ! ઝોહર સે પહલે જિન સાહિબ કી આમદ પર ઉઠ કર સબ ને તા'ઝીમ કી થી વોહ હઝરતે સય્યિદુના હસન બસરી عَلَيْهِ رَحْمَةُ اللَّهِ الْقَوِي થે ! વોહ અપની કરામત સે બસરા શરીફ સે યહાં મિના શરીફ કી મસ્જિદુલ ખૈફ મેં તશરીફ લા કર રોઝાના નમાઝે ઝોહર અદા ફરમાતે હૈં. (ماخوذاً تذكرة الاولياء ج ١ ص ٤٠) અલ્લાહ ઈઝ્ઝલ્ કી ઉન પર રહમત હો ઔર ઉન કે સદકે હમારી બે હિસાબ મગ્ફિરત હો.

أَمِينٍ بِجَاوِزِ النَّبِيِّ الْأَمِينِ صَلَّى اللَّهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ

આખિરી ઉમ્મ હૈ કયા રૌનકે દુન્યા દેખૂં

અબ તો બસ એક હી ધુન હૈ કે મદીના દેખૂં

صَلُّوْا عَلَى الْحَبِيبِ ! صَلَّى اللَّهُ تَعَالَى عَلَى مُحَمَّدٍ

હાફિઝે કી તબાહી કા એક સબબ

એ દીદારે મદીના કે આરઝૂ મન્દ આશિકાને રસૂલ ! દેખા આપ ને !

અમ્મદ કી તરફ “ગન્દી લઝ્ઝત” કે સાથ દેખને સે હાફિઝા ભી તબાહ

કરમાને મુસ્તકા : ضَلَى اللّٰهُ تَعَالَى عَلَيْهِ وَالْوَالِدِينَ وَسَلَّمَ : મુઝ પર દુરુદ શરીફ પઢો અલ્લાહ جَلَّ وَجَلَّ તુમ પર રહમત ભેજેગા. (ابن عمر)

હો સકતા હૈ. આજ કલ યાદ દાશત કી કમી કી શિકાયત આમ હૈ, હુફફાઝ કી ભી એક તા'દાદ હાફિઝે કી કમઝોરી કી આફત મેં મુબ્તલા હૈ ઓર બહુત સોં કો તો કુરઆને પાક હી ભુલા દિયા જાતા હૈ (કુરઆન શરીફ યા ફુલાં આયત “ભૂલ” ગયા કહને કે બજાએ “ભુલા દિયા ગયા” કહના મુનાસિબ હૈ) બદ નિગાહી ઓર T.V. વગૈરા પર ફિલ્મેં ડિરામે દેખના ગુનાહ વ હરામ ઓર જહન્નમ મેં લે જાને વાલા કામ હૈ ઓર ઈસ સે હાફિઝા ભી કમઝોર હો જાતા હૈ. હાફિઝા કમઝોર હોને કે ઓર ભી કઈ અસ્બાબ હૈં લિહાઝા ખબરદાર ! કિસી હાફિઝ સાહિબ કી મન્જિલ કમઝોર હોને કી સૂરત મેં મહૂઝ અપની અટકલ સે યેહ ઝેહૂન બના લેના કે બદ નિગાહી કે સબબ ઐસા હુવા હૈ, બદ ગુમાની હૈ ઓર મુસલ્માન પર બદ ગુમાની હરામ ઓર જહન્નમ મેં લે જાને વાલા કામ હૈ.

દો અમ્રદ પસન્દ મુઅઝિઝનોં કી બરબાદી

ઐ ઈમાન કી હિફાઝત કે લિયે કુઢને વાલે મદીને કે દીવાનો ! બદ ફે'લી કી નૌબત ન ભી આએ તબ ભી બદ નિગાહી સે નીઝ અમ્રદ કે સાથ દિલચસ્પી રખને ઓર દોસ્તી કરને સે ઈમાન બરબાદ હો જાને કા ભી અન્દેશા હૈ. એક દિલ હિલા દેને વાલી હિકાયત પઢિયે ઓર ખૌફે ખુદા સે લરઝિયે : યુનાન્થે હઝરતે સચ્ચિદુના અબ્દુલ્લાહ બિન અહમદ મુઅઝિઝن رَحْمَةُ اللهِ تَعَالَى عَلَيْهِ ફરમાતે હૈં : મૈં તવાફે કા'બા મેં મશ્ગૂલ થા કે એક શખ્સ પર નઝર પડી જો ગિલાફે કા'બા સે લિપટ કર એક હી દુઆ કી તકરાર કર રહા થા : “યા અલ્લાહ جَلَّ وَجَلَّ મુઝે દુન્યા સે મુસલ્માન હી રુખ્સત કરના.” મૈં ને ઉસ સે પૂછા : ઈસ કે ઈલાવા કોઈ ઓર દુઆ ક્યું નહીં માંગતે ? ઉસ ને કહા : મેરે

કરમાને મુસ્તફી ﷺ : صَلَّى اللهُ عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ : মুজ পর কসরত সে দুর্ভে পাক পড়ো বেশক তুম্ভারা মুজ পর দুর্ভে পাক পড়না
তুম্ভারে গুনাছোঁ কে লিখে মগফিরত ছে. (১৮৫)

દો^૨ ભાઈ થે, બડા ભાઈ ચાલીસ^{૪૦} સાલ તક મસ્જિદ મેં બિલા મુઆ-
વઝા અઝાન દેતા રહા, જબ ઉસ કી મૌત કા વક્ત આયા તો ઉસ ને
કુરઆને પાક માંગા, હમ ને ઉસે દિયા તા કે ઈસ સે બ-ર-કતેં હાસિલ
કરે, મગર કુરઆન શરીફ હાથ મેં લે કર વોહ કહને લગા : “તુમ
સબ ગવાહ હો જાઓ કે મેં કુરઆન કે તમામ એ’તિકાદાત વ
અહકામાત સે બેઝાર હૂં ઓર નસરાની (યા’ની કિસ્થેન) મઝહબ
ઈખ્તિયાર કરતા હૂં.” ફિર વોહ મર ગયા. ઈસ કે બા’દ દૂસરે ભાઈ
ને તીસ^{૩૦} બરસ તક મસ્જિદ મેં ફી સબીલિલ્લાહ અઝાન દી. મગર
ઉસ ને ભી આખિરી વક્ત નસરાની (યા’ની કિસ્થેન) હોને કા એ’તિરાફ
કિયા ઓર મર ગયા. લિહાઝા મેં અપને ખાતિમે કે બારે મેં બેહદ ફિક
મન્દ હૂં ઓર હર વક્ત ખાતિમા બિલખૈર કી દુઆ માંગતા રહતા હૂં.
હઝરતે સય્યિદુના અબ્દુલ્લાહ બિન અહમદ મુઅઝ્ઝિન رَحْمَةُ اللهِ تَعَالَى عَلَيْهِ
ને ઉસ સે ઈસ્તિફસાર ફરમાયા કે તુમ્હારે દોનો^૨ ભાઈ આખિર ઐસા
કૌન સા ગુનાહ કરતે થે ? ઉસ ને બતાયા : “વોહ ગૈર ઓરતોં મેં
દિલચસ્પી લેતે થે ઓર અમ્રદોં (યા’ની બે રીશ લડકોં) કો (શહ્વત
સે) દેખતે થે.”

(الرَّوْضُ الْفَائِقُ ص ۱۷)

अतार हें ईमां की छिड़ाजत का सुवाली

ખાલી નહીં જાએગા યેહ દરબારે નબી સે

(વસાઈલે બખ્શિશ, સ. 203)

صَلُّوْا عَلَى الْحَبِيبِ ! صَلَّى اللهُ تَعَالَى عَلَى مُحَمَّدٍ

ચેહરે કા ગોશત ઝડ ગયા

એક બુઝુર્ગ رَحْمَةُ اللهِ تَعَالَى عَلَيْهِ કો બા’દે ઈન્તિકાલ ખ્વાબ મેં દેખ કર

करमान मुस्तक! صلى الله على وآله وسلم : जो मुज पर अक दुरेद शरीक पढता है अल्लाह एउज उस के लिये अक किरात अजर विभता है और किरात उहुद पढाउ जितना है. (Juz'ah)

किसी ने पूछा : يا'नी अल्लाह عزوجل ने आप के साथ क्या मुआ-मला किया ? कहने लगे : मुझे बारगाहे जुदा वन्दी عزوجل में पेश किया गया और मेरे गुनाह गिनवाने शुरू किये गये, मैं ँकरार करता गया और वोह मुआफ़ होते गये, मगर अक गुनाह पर शर्म के मारे मैं युप हो गया और देखते ही देखते मेरे येहरे की भाल और गोशत सब कुछ उड गया. ज्वाब देखने वाले ने पूछा : आपिर वोह गुनाह कौन सा था ? इरमाया : "अइसोस ! अक बार मैं ने अक अम्रद (या'नी बे रीश लडके) पर शह्वत भरी नजर डाल दी थी."

(किमियाँ سعادت ج २ ص १००)

शह्वत से लिभास देभना भी हराम

अै भौंके जुदा और ँशके मुस्तफ़ा रभने वाले ँस्लामी भाँयो ! लरज उठिये ! के जब अम्रद को शह्वत के साथ देखने का ँस कदर भौंफ़नाक अन्जाम है ! तो न जाने बद ई'ली का का अजाब किस कदर शदीद होगा. दा'वते ँस्लामी के ँशाअती ँदारे मक-त-भतुल मदीना की मत्बूआ 1197 सफ़हात पर मुश्तमिल किताब, "बहारे शरीअत (जिल्द 3)" सफ़हा 442 पर है : लडका जब मुराहिक (या'नी बालिग होने के करीब) हो जाअे और वोह भूब सूरत न हो तो नजर के बारे में ँस का वोही हुकम है जो मर्द का है और भूब सूरत हो तो औरत का जो हुकम है वोह ँस के लिये है या'नी शह्वत के साथ ँस की तरफ़ नजर करना हराम है और शह्वत न हो तो उस की तरफ़ नजर भी कर सकता है और उस के साथ तन्हाँ भी जाँठ है. शह्वत न होने का मतलब येह है के उसे यकीन हो के नजर करने से शह्वत न होगी और अगर ँस का शुभा भी हो तो हरगिज नजर न करे, बोसा

करमाने मुस्तक। صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ : जिस ने किताब में मुज पर दुरइ पाक लिखा तो जब तक मेरा नाम उस में रहेगा फिरश्ते उस के लिये ईस्तिफ़ार करते रहेंगे. (अ/)

(लेने) की प्वालिश पैदा होना भी शह्वत की हद में दामिल है। (رَدُّ الْمُحْتَار १ ج ص १०२) याद रहे ! अमरद के इकत येहरे ही को शह्वत के साथ देभना गुनाह नहीं, निगाहें नीची होने के बा वुजूद अमरद के सीने या हाथ या पाउं वगैरा बटके सिर्फ़ लिबास ही पर नजर पड रही हो और “गन्दी लज़्जत” आ रही हो तो उन आ’जा या लिबास को देभना भी गुनाह व हराम और जहन्नम में ले जाने वाला काम है। अगर किसी लउके की तरफ़ बार बार देभने को ज़ याह रहा हो और गन्दी लज़्जत के बाईस वहां से हटने का हिल न करता हो, अगर ऐसा है तो वहां से फ़ौरन हट जाओ. अगर अल्लाह शह्वत के बा वुजूद उस को देभा या वहां रहा तो गुनहगार और जहन्नम का हकदार है।

भौइनाक सांप की झर्ब

अेक बुज़ुर्ग رَحْمَةُ اللهِ تَعَالَى عَلَيْهِ को ईन्तिकाल के बा’द प्वाब में देभा गया के उन का आधा येहरा सियाह है. वजह पूछने पर बताया के जन्नत में जाते हुअे जहन्नम पर से जूंही गुजरा, अेक भौइनाक सांप बरआमद हुवा और उस ने मेरे येहरे पर अेक ज़ोरदार झर्ब लगाते हुअे कहा : तूने इलां दिन अेक अमरद को शह्वत के साथ देभा था येह उस बह निगाही की सजा है अगर तू ज़ियादा देभता तो मैं ज़ियादा सजा देता. (تَذَكُّرَةُ الْاَوْلِيَاءِ ج ١ ص ٦٤)

शह्वत परस्ती के मुप्तलिइ अन्दाज

अै बरोजे कियामत मक्की म-हनी आका صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ की मुस्कराती नूर बरसाती हसीन सूरत देभने के आरजू मन्ह आशिकाने रसूल ! गौर तो कीजिये ! जब भ न-उरे शह्वत देभने

करमाने मुस्तफ़ی علیہ وآلہ وسلم : जिस ने मुझ पर अेक बार दुइडे पाक पढा अल्लाह ज़ं उस पर दस रकमतें बेजता है. (स्)

का अन्जाम ँस कदर डोलनाक है तो इर शह्वत के साथ अमरद की मुस्कराहट से लुर्क अन्दोज डोना, बलके षुद उस के सामने “गन्दी लज़्जत” के साथ ँस लिये मुस्कराना ता के वोड ली मुस्कराअे येड किस कदर तबाह कुन डोगा ! नीज अमरद के साथ मजीद येड काम ली शह्वत के साथ करना डराम हैं : ँस से दोस्ती और डंसी मजाक करना, ँस को छेड कर, गुस्सा दिवा कर ँस के ँजतिराब (या’नी बेयैनी) से “गन्दा मजा” डसिल करना, ँस को आगे या पीछे स्कूटर पर सुवार करना, उस से लिपटना, उस से डथ मिलाना, गले मिलना, उस से अपना जिस्म टकराना, उस से अपना सर पाँ या कमर वगैरा डभवाना, मरज वगैरा में उठते बैठते या यलते लुअे उस के डथ का सडारा लेना, उस को तीमार डारी के लिये रषना, उस को अपने यडं मुलाजिम रषना, मजाक में उस को डबोय कर गिराना, उस का डथ पकड कर या उस के कन्धे पर डथ रष कर यलना, ँजतिमाअ वगैरा में उस के करीब बैठना, उस के पास बैठ कर उस की रान पर अपना घुटना रषना या उस का घुटना अपनी रान पर रडने डेना, **مَكْرَهَاتُ** मख्रिह के अन्दर नमाजे वा जमाअत में उस से कन्धा यिपका कर षड डोना, वगैरा वगैरा. **मस्अला** : जमाअत में ँस तरड मिल कर षड डोना वाजिब है के कन्धे से कन्धा छिल रड डो या’नी अेक का कन्धा दूसरे के कन्धे से षूब मिला लुवा डो अलबत्ता डराडर में अमरद षड डो और कन्धा मिला कर षडे डोने से शह्वत आती डो तो वडं से डट जअे, वरना गुनडगार डोगा.

डोसा लेने का अजाम

मन्कूल है : “जे किसी लडके का (शह्वत के साथ) डोसा लेगा वोड

करमाने मुस्तफ़ा : عَلَى اللَّهِ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ : जो शप्स मुज पर दुरदे पाक पढना भूल गया वोह जन्त का रास्ता भूल गया. (قرآن)

पांय सो साल जलन्म की आग में जलाया जायेगा.” (مُكَاشَفَةُ الْقُلُوبِ ص ٧٦)

औ अजाबे नार की सहार न रभने वाले जारो नजार बन्दो ! अगर कभी “अम्रद” के तअल्लुक से बढ निगाही या बोसा बाजी वगैरा किसी तरह का भी गुनाह कर बैठे हैं तो पौड़े भुदा عَزَّ وَجَلَّ से लरज उठिये और धबरा कर अद्लाह عَزَّ وَجَلَّ की बारगाह में रुजूअ कर लीजिये, सख्खी पक्की तौबा कर के इस तरह के बढे हर तरह के गुनाहों से आयन्दा बयने का अज़्मे मुसम्मम कर लीजिये. ખबरदार ! अम्रद की दोस्ती से बाज रहने की तल्कीन करने वाले भैर प्वाह पर नाराज मत हों, शैतान के उक्साने पर, ताव में आ कर, बल भा कर, नासेह (या’नी नसीहत करने वाले) को दलाईल में उलजा कर, उस पर अपनी पारसाई का सिक्का जमा कर हो सकता है के यन्द् रोजा जिन्दगी में आप रुस्वाई से बय भी जाअें, मगर याद रभिये ! रब्बे जुल जलाल عَزَّ وَجَلَّ दिलों के अहवाल से भा ખबर है.

धुप के लोगों से किये जिस के गुनाह

वोह खबरदार है क्या होना है

(हदाईके बप्शिश शरीफ)

बढ निगाही से शकल बिगाड सकती है

सरकारे मदीना, करारे कल्बो सीना صَلَّى اللَّهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ ने ईशाई इरमाया : “तुम या तो अपनी निगाहें नीची रभोगे और अपनी शर्मगाहों की डिङ्गाजत करोगे या फिर अद्लाह عَزَّ وَجَلَّ तुम्हारी शकलें बिगाड देगा.” (الْمُعْجَمُ الْكَبِيرُ لِلطَّبْرَانِيِّ ج ٨ ص ٢٠٨ حديث ٧٨٤٠)

कल में कीडे सभ से पहले तेरी आंभ जायेंगे

औरतों और अम्रदों वगैरा से बढ निगाही करने वालो खबरदार !

इरमाने मुस्तक़ा صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ : जिस के पास मेरा जिक्र हुआ और उस ने मुझ पर दुर्इदे पाक न पढा तहकीक वोह
बदबपत हो गया. (उद्दा)

दा'वते इस्लामी के इशाअती इदारे मक-त-बतुल मदीना की मत्बूआ 54 सइफ़ात पर मुश्तमिल किताब, "नसीहतों के म-दनी इ़ल" सइहा 44 पर है : (अल्लाह عَزَّ وَجَلَّ इरमाता है औ इब्ने आदम !) मेरी हराम कर्दा चीजों की तरफ़ मत देख (कफ़्र में) कीउे सब से पहले तेरी आंभु भाअेंगे. याद रभ ! हराम पर नज़र और उस की महब्बत पर तेरा मुहा-सबा (या'नी पूछगछ) किया जाअेगा. और कल बरोजे कियामत मेरे हुज़ूर भडे होने को याद रभ ! क्यूंके मैं लम्हा त्बर के लिये भी तेरे राजों से गाइल नहीं होता, बेशक मैं हिलों की बात जानता हूं.

नज़र की हिफ़ाज़त करने वाले के लिये जहन्नम से अमान है

जो अमरदों और गैर औरतों वगैरा की मौजू-दगी में आंभें जुकाता, अपनी गन्दी ज्वाहिश दबाता और उन को देखने से जुद को बयाता है वोह काबिले सद मुबारक बाद है युनान्हे "नसीहतों के म-दनी इ़ल" सइहा 30 पर है : (अल्लाह عَزَّ وَجَلَّ इरमाता है) जिस ने मेरी हराम कर्दा चीजों से अपनी आंभों को जुका लिया (या'नी उन्हें देखने से बया) मैं उसे जहन्नम से अमान (पनाह) अता कर दूंगा.

घबलीस का ग़हरीला तीर

अल्लाह عَزَّ وَجَلَّ के महबूब, दानाअे गुयूब, मुनज़्ज़हुन अनिल उयूब صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ का इरमाने हलावत निशान है के हदीसे कुदसी (या'नी इरमाने जुदाअे रहमान عَزَّ وَجَلَّ) है : नज़र इब्लीस के तीरों में से अेक ज़रूर में जुजा हुवा तीर है पस जो शप्स मेरे भौफ़ से इसे तर्क कर दे तो मैं उसे औसा इमान अता करूंगा जिस की हलावत (या'नी मिठास) वोह अपने हिल में

ફરમાને મુસ્તફા : صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ : जिस ने मुझ पर दस मरतबा सुबह और दस मरतबा शाम दुइडे पाक पढा
(उसे क्रियामत के दिन मेरी शक्राअत मिलेगी. (रुह))

પાએગા. (الْمُعْجَمُ الْكَبِيرُ لِلطَّبْرَانِيِّ ج ١٠ ص ١٧٣ حدیث ١٠٣٦٢)

અમરદ કે સાથ તન્હાઈ સાત દરિન્દોં સે ભી ઝિયાદા ખતરનાક

એક તાબેઈ બુઝુર્ગ عَلَيْهِ رَحْمَةُ اللهِ تَعَالَى ફરમાતે હેં : “મૈં નૌ જવાન સાલિક (યા'ની ઈબાદત ગુઝાર નૌ જવાન) કે સાથ બે રીશ લડકે કે બૈઠને કો સાત દરિન્દોં સે ઝિયાદા ખતરનાક સમઝતા હૂં.” મઝીદ ફરમાતે હેં : “કોઈ શખ્સ એક મકાન મેં કિસી અમરદ કે સાથ તન્હા રાત ન ગુઝારે.” ઈમામ ઈબને હજર મક્કી શાફેઈ عَلَيْهِ رَحْمَةُ اللهِ تَعَالَى ફરમાતે હેં : બા'ઝ ઉ-લમાએ કિરામ رَحْمَةُ اللهِ تَعَالَى ને અમરદ કો ઔરત પર ક્રિયાસ કરતે હુએ ઘર, દુકાન યા હમ્મામ મેં ઈસ કે સાથ ખલ્વત (યા'ની તન્હાઈ) કો હરામ કરાર દિયા ક્યૂંકે શફીઉલ મુઝ્નિબીન, અનીસુલ ગરીબીન صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ કા ફરમાને હકીકત નિશાન હૈ : “જો શખ્સ કિસી ઔરત (અજનબિયા) કે સાથ તન્હા હોતા હૈ તો વહાં તીસરા શૈતાન હોતા હૈ.” (تَرْوِيذِي ج ٤ ص ٦٧ حدیث ٢١٧٢)

અમરદ ઔરત સે ભી ઝિયાદા ખતરનાક હૈ !

હઝરતે સય્યિદુના ઈમામ ઈબને હજર મક્કી શાફેઈ عَلَيْهِ رَحْمَةُ اللهِ تَعَالَى લિખતે હેં : જો અમરદ ઔરતોં સે ઝિયાદા ખૂબ સૂરત હોતા હૈ ઉસ મેં ફિતના ભી ઝિયાદા હોતા હૈ, ઈસ લિયે કે ઉસ સે ઔરતોં કી નિસ્બત બુરાઈ કા ઝિયાદા ઈમ્કાન હોતા હૈ લિહાઝા ઉસ કે સાથ તન્હાઈ ઈખ્તિયાર કરના બ દ-ર-જએ ઔલા હરામ હૈ. (مُلَخَّصُ الزَّكَاوَاتِ ج ٢ ص ١٠) અહ્નાફ કે નઝદીક શહ્વત ન હો તો અમરદ કે સાથ તન્હાઈ હરામ નહીં. તાહમ બા'ઝ શવાફેઅ કે નઝદીક અમરદ કે સાથ તન્હાઈ કા મુત્લકન હરામ હોના હમેં એહતિયાત કા દર્સ દેતા હૈ.

करमाने मुस्तफ़ा صلى الله تعالى عليه واله وسلم : जिस के पास मेरा जिक्र हुआ और उस ने मुझ पर दुइद शरीफ़ न पढा उस ने जफ़ा की. (ज़िज़्ज़ा)

अमरद के साथ 17 शयातीन

उठरते सय्यिदुना सुफ़यान सौरी رحمه الله القوی अेक हम्माम में दाखिल हुअे, आप رحمه الله تعالى عليه के पास अमरद या'नी अेक बेरीश लडका आया तो ईशाद ईरमाया : ईसे मुज से दूर कर दो क्यूंके मैं हर औरत के साथ अेक शैतान जब के हर अमरद के साथ 17 शयातीन देजता हूं. (ایضاً)

अमरद “आग” हे

भीठे भीठे ईस्लामी भाईयो ! अल्लाहु गइफ़ार हमें अजाबे नार से मडकूज ईरमाअे और अमरद के गुनाहों तरे कुर्ब से उम्र तरे बयाअे रभे. امين بجاه النبي الامين صلى الله تعالى عليه واله وسلم. जेहून बना लीजिये के बद निगाही की आइत और अमरद की नजदीकी की मुसीबत से हर डाल में ان شاء الله عزوجل अपनी डिफ़ाजत करेंगे. दा'वते ईस्लामी के ईशाअती ईदारे मक-त-बतुल मदीना की मत्बूआ 504 सइहात पर मुशतमिल किताब, “गीबत की तबाह कारियां” सइहा 239 पर है : भबरदार ! अमरद तो आग हे आग ! अमरद का कुर्ब, उस की दोस्ती उस के साथ मजाक मस्भरी, आपस में कुशती, भींयातानी और लिपटा लिपटी जहन्नम में जोंक सकती है. अमरद से दूर रहने डी में आइय्यत है अगर्वे उस बेयारे का कोई कुसूर नहीं, अमरद होने के सबब उस की दिल् आजारी भी मत कीजिये, मगर उस से अपने आप को बयाना बेहद जइरी है. हरगिज अमरद को स्कूटर पर अपने

ફરમાને મુસ્તફા ﷺ : ﷺ : જો મુઝ પર રોઝે જુમુઆ દુરૂદ શરીફ પઢેગા મેં કિયામત કે દિન ઉસ કી શકાઅત કરંગા. (ક્રમલ)

પીછે મત બિઠાઈયે, ખુદ ભી ઉસ કે પીછે મત બૈઠિયે કે આગ આગે હો યા પીછે ઉસ કી તપિશ હર સૂરત મેં પહોંચેગી. શહ્વત ન હો જબ ભી અમ્રદ સે ગલે મિલના મહલ્લે ફિતના (યા'ની ફિતને કી જગહ) હૈ, ઔર શહ્વત હોને કી સૂરત મેં ગલે મિલના બલ્કે હાથ મિલાના (હરામ) બલ્કે ફુ-કહાએ કિરામ رَحْمَةُ اللَّهِ السَّلَام ફરમાતે હૈં : અમ્રદ કી તરફ શહ્વત કે સાથ દેખના ભી હરામ હૈ. (ذُرْمُخْتَار ج ٢ ص ٩٨، تفسيرات احمدية ص ٥٥٩) ઉસ કે બદન કે હર હિસ્સે હતા કે લિબાસ સે ભી નિગાહોં કો બચાઈયે. ઈસ કે તસવ્વુર સે અગર શહ્વત આતી હો તો ઈસ સે ભી બચિયે, ઉસ કી તહરીર યા કિસી ચીઝ સે શહ્વત ભડકતી હો તો ઉસ સે નિસ્બત રખને વાલી હર ચીઝ સે નઝર કી હિફાઝત કીજિયે, હતા કે ઉસ કે મકાન કો ભી મત દેખિયે. અગર ઉસ કે વાલિદ યા બડે ભાઈ વગૈરા કો દેખને સે ઉસ કા તસવ્વુર કાઈમ હોતા હૈ ઔર શહ્વત ચઢતી હૈ તો ઉન કો ભી મત દેખિયે.

અમ્રદ કે સાથ 70 શૈતાન

અમ્રદ કે ઝરીએ કિયે જાને વાલે શૈતાને અચ્ચાર વ મક્કાર કે તબાહ કાર વાર સે ખબરદાર કરતે હુએ મેરે આકા આ'લા હઝરત રَحْمَةُ اللَّهِ تَعَالَى عَلَيْهِ ફરમાતે હૈં : મન્કૂલ હૈ : ઔરત કે સાથ દો? શૈતાન હોતે હૈં ઔર અમ્રદ કે સાથ સત્તર. (ફતાવા ર-ઝવિયા, જિ. 23, સ. 721)

અમ્રદ ભાન્જે કો સાથ લે કર ન નિકલો !

એક શખ્સ કરોડોં હમ્બલિયોં કે અઝીમ પેશવા હઝરતે સચ્ચિદુના ઈમામ અહમદ બિન હમ્બલ رَحْمَةُ اللَّهِ تَعَالَى عَلَيْهِ કી ખિદમત મેં

ફરમાને મુસ્તકા : صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ : مُؤْتَىٰ عَلَىٰ كَسْرَتِ كَرِيءٍ يَخْتَلِعُ فِيهَا خَيْبَةٌ (المؤمنين)

હાઝિર હુવા. ઉસ કે સાથ એક ખૂબ સૂરત લડકા થા. આપ
رَحْمَةُ اللهِ تَعَالَى عَلَيْهِ ने उस से दरयाईत फरमाया : तुम्हारे साथ येह कौन
है ? अर्ज की : “येह मेरा त्मान्ना है.” फरमाया : आयन्दा एसे ले
कर मेरे पास न आना और एसे साथ ले कर रास्ते में न निकला
करो ता के एसे और तुम्हें न जानने वाले बद् गुमानी न करें.

(الزَّوْجَر ۲ ص ۱۲)

परहेज गार भी इंस जाते हैं

એક બુઝુર્ગ رَحْمَةُ اللهِ تَعَالَى عَلَيْهِ سے એક બાર શૈતાન ને કહા : દુન્યા
કે માલ કી મહબબત સે તો બચને મેં આપ જૈસે લોગ કામ્યાબ હો જાતે
હેં, મગર મેરે પાસ અમ્રદ કી કશિશ કા જાલ એસા હૈ કે ઇસ મેં બડે
બડે પરહેજ ગારોં કો ફંસા લેતા હૂં.

અમ્રદ કે ફિતને સે બચો

મીઠે મીઠે ઇસ્લામી ભાઈયો ! અમ્રદ યા'ની બે રીશ લડકા
મર્દ કે લિયે ઉમૂમન પુર કશિશ હોતા હૈ, ઇસ મેં બઝાતે ખુદ અમ્રદ
બે કુસૂર હૈ ઓર ઇસ હવાલે સે ઇસ કી દિલ આઝારી ગુનાહ
હૈ, બસ મર્દ કો ચાહિયે કે વોહ ઇસ સે મોહતાત રહે. બુઝુર્ગાને
દીન رَحْمَةُ اللهِ تَعَالَى عَلَيْهِ ने अम्रद से दूर रहने की सप्त ताकीद फरमाई
है. જૈસા કે દા'વતે ઇસ્લામી કે ઇશાઅતી ઇદારે મક-ત-બતુલ
મદીના કી મત્બૂઆ 1012 સફહાત પર મુશ્તમિલ કિતાબ,
“જહન્નમ મેં લે જાને વાલે આ'માલ (જિલ્દ 2)” સફહા 31 તા
32 પર હૈ : ઇસી લિયે સાલિહીન رَحْمَةُ اللهِ تَعَالَى عَلَيْهِ ने अम्रदों (या'नी
બે રીશ લડકોં) કો (બિલા શહવત ભી) દેખને, ઇન સે ખલ્ત

ફરમાને મુસ્તફા ﷺ : طى الله تعالى عليه واله وسلم : तुम जहां भी हो मुज पर दुरद पढो के तुम्हारा दुरद मुज तक पछोंयता है. (طرائق)

મલ્ત (યા'ની ગુડમુડ) હોને ઓર (શહવત ન આતી હો તબ ભી) ઉન કે સાથ બૈઠને સે બચને કે મુ-તઅલ્લિક મુબા-લગા ફરમાયા. (યા'ની બચને કી બહુત ઝિયાદા તાકીદ ફરમાઈ)

શહવત કી પહયાન

લડકા દેખ કર ચિપટા લેને યા બોસા લેને કો જી ચાહના, યેહ શહવત કી અલામતેં હૈં. હાં બહુત છોટે બચ્ચે કો બિગૈર શહવત કે બોસા લેને મેં હરજ નહીં.

“યા રબ ! મેરી તૌબા” કે બારહ હુરફ કી નિરબત સે ઇસ્લામી ભાઈયોં કે લિયે શહવત સે બચને કે 12 મ-દની ફૂલ

﴿1﴾ દાઢી વાલા હો યા બે રીશ બલ્કે જાનવર કો દેખ કર ભી શહવત આતી હો તો ઉસ કી તરફ દેખના હરામ હૈં ﴿2﴾ મવેશિયોં, જાનવરોં ઓર પરિન્દોં કી શર્મગાહોં ઓર ઉન કી જુફિતયોં યા'ની “મિલાપોં” બલ્કે મખ્ખિયોં ઓર કીડે મકોડોં કે “મિલન” કે મનાઝિર ભી ગન્દી લઝ્ઝતોં કે સાથ દેખના ના જાઈઝ વ ગુનાહ હૈં, ઐસે મવાકેઅ પર ફૌરન નઝર હટા લે બલ્કે જૂં હી ઈસ કે “આસાર” મહસૂસ હોં ફૌરન વહાં સે હટ જાએ. ﴿3﴾ જો લોગ મવેશી યા પરિન્દે ઓર મુર્ગિયાં બેચતે યા પાલતે હૈં ઉન કો ઈસ હવાલે સે બહુત મોહતાત રહને કી ઝરૂરત હૈં ﴿4﴾ અગર શહવત આતી હો તો નમાઝ મેં ભી સફ કે અન્દર અમ્રદ કે બરાબર ન ખડે હોં ﴿5﴾ દર્સ વ ઈજતિમાઅ વગૈરા મેં ભી અમ્રદ કે કરીબ ન બૈઠિયે ﴿6﴾ ઈજતિમાઅ યા નમાઝ કી સફ મેં અમ્રદ કરીબ આ જાએ ઓર અભી આપ ને નમાઝ ન શુરૂઅ કી હો ઓર અન્દેશાએ શહવત હો તો ઉસ કો ન હટાઈયે, આપ ખુદ વહાં સે

કરમાને મુસ્તફા ﷺ : طي الله تعالى عليه والواو سلم : जिस के पास मेरा ठिक छो और वोह मुज पर दुइइ शरीफ न पढे तो वोह
 लोगों में से कजूस तरीन शप्स है. (त्रिभे. ५)

હટ જાઈયે ﴿7﴾ અમ્રદ કો દેખને સે જિસે શહ્વત આતી હો ઉસે અમ્રદ સે નઝર કી હિફાઝત વાજિબ હૈ ઓર ઐસી જગહ સે ભી બચના ચાહિયે જહાં અમ્રદ હોતે હોં ﴿8﴾ સાઈકિલ પર આગે યા પીછે કિસી ગૈર અમ્રદ કો ભી ઈસ તરહ બિઠાના કે ઉસ કી રાન વગૈરા સે ઘુટના ટકરાએ મુનાસિબ નહીં ﴿9﴾ શહ્વત કે બા વુજૂદ દૂસરે કો આગે યા પીછે સ્કૂટર યા સાઈકિલ પર બિઠાના હરામ હૈ ﴿10﴾ એહતિયાત ઈસી મેં હૈ કે ડબલ સુવારી કે દૌરાન મોટી યાદર વગૈરા ઈસ તરહ બીચ મેં હાઈલ કર દી જાએ કે દોનોં² કે જિસ્મ કા હર હિસ્સા એક દૂસરે સે ઈસ તરહ જુદા રહે કે એક કે બદન કી ગરમી દૂસરે કો ન પહોંચે, ઈસ કે બા વુજૂદ અગર કિસી કો શહ્વત આએ તો ફૌરન સ્કૂટર રોક કર જુદા હો જાએ વરના ગુનહગાર હોગા ﴿11﴾ સ્કૂટર પર તીન સુવારિયોં કા ચિપક કર બૈઠના સખ્ત ના પસન્દીદા ફે'લ હૈ નીઝ હાદિસે કા ખતરા હોને કી વજહ સે પાકિસ્તાન મેં કાનૂનન ભી જુર્મ હૈ ﴿12﴾ ઐસી ભીડ યા કિતાર મેં કસ્દન શામિલ હોને સે બચેં જિસ મેં આદમી એક દૂસરે કે પીછે ચિપકતે હૈં ઓર અગર શહ્વત આતી હો તો હરામ હૈ. યાદ રખિયે ! અપને આપ કો જો શૈતાન સે મહફૂઝ સમઝો, બસ સમઝો ઉસ પર શૈતાન કામ્યાબ હો ચુકા.

ભીડ મેં કિસી કો ભી ઘુસના નહીં ચાહિયે !

હુજૂમ યા કિતાર વગૈરા મેં જબ પીછે સે ધક્કે લગ રહે હોં તો અમ્રદ કો ફૌરન ઉધર સે નિકલ જાના મુનાસિબ હૈ બલકે જહાં ચિપકા ચિપકી ઓર ધક્કા ધક્કી હો રહી હો વહાં અમ્રદ કો ઘુસના હી નહીં ચાહિયે કે કહીં ઉસ કી વજહ સે કોઈ શખ્સ “ગુનહગાર” ન હો જાએ. જબ ભી કોઈ ચીઝ તક્સીમ કી જા રહી

ફરમાને મુસ્તફા صَلَّی اللہُ تَعَالٰی عَلَیْہِ وَاٰلِہٖ وَسَلَّم : اِس شَاطِسْ کِی نَاک بَاک آوِاؤدُ اِی جِیس کِے پَاس مِیرا جِیکُ اِی اَوِیر وَوِیڈ مُجھُ پَر دُڑدِے پَاک ن پَدِے. (۱۶)

હો યા કિસી કો દેખને યા ઉસ સે મિલને કે લિયે હુજૂમ હો એસે મવાકેઅ પર ધક્કમ પીલ સે અમ્રદ ઓર ગૈરે અમ્રદ સભી કો બચના યાહિયે. હર એક જાનતા હૈ કે કા'બતુલ્લાહ કે અન્દર દાખિલ હોના બહુત બડી સઆદત હૈ મગર એસે મૌકઅ પર ભી ભીડભાડ મેં ઘુસને સે બચને કી તાકીદ કરતે હુએ સદરુશરીઅહ رَحْمَةُ اللّٰهِ تَعَالٰی عَلَیْہِ ફરમાતે હૈં : “ઝબર દસ્ત (યા'ની તાકત વર) મર્દ (કા'બે શરીફ મેં દાખિલ હોતે વક્ત દબને કુચલને સે) આપ બચ ભી ગયા તો ઓરોં કો ધક્કે દે કર ઈજા દેગા ઓર યેહ જાઈઝ નહીં.” (બહારે શરીઅત, જિ. 1, સ. 1150) તવાફ મેં હ-જરે અસ્વદ કો ચૂમના સરકારે મદીના صَلَّی اللّٰهُ تَعَالٰی عَلَیْہِ وَآلِہٖ وَسَلَّم સે સાબિત હૈ મગર ઈસ કે લિયે હુજૂમ મેં ઘુસને કી મુમા-ન-અત કરતે હુએ આ'લા હઝરત رَحْمَةُ اللّٰهِ تَعَالٰی عَلَیْہِ ફરમાતે હૈં કે : ઈસ કે લિયે “ન ઓરોં કો ઈજા દો ન આપ દબો કુચલો” બલકે..... હાથોં સે ઉસ કી તરફ ઈશારા કર કે ઉન્હેં બોસા દે લો. ۱۰۰ (ફતાવા ર-ઝવિયા, જિ. 10, સ. 739) બહર હાલ હુજૂમ મેં ઘુસને સે બચના યાહિયે કે કહીં હમારી વજહ સે કિસી કો ઈજા ન પહોંચ જાએ. મેં ને કઈ સમઝદાર ઈસ્લામી ભાઈયોં કો દેખા હૈ કે ભીડ કે મૌકઅ પર દૂર ખડે રહતે હૈં, હર એક કો એસા હી કરના યાહિયે. અગર કભી હુજૂમ મેં ઘિર ભી જાએં તો ઈસ સે પહલે કે ધક્કમ પીલ શુરૂઅ હો બાહર નિકલને કી તરકીબ કરની યાહિયે મગર નિકલતે હુએ ભી કિસી કો ઈજા ન હો ઈસ કા ખયાલ રખા જાએ.

ઇમામે આ'ઝમ કા અમ્રદ કે બારે મેં તર્જો અમલ

હઝરતે સય્યિદુના ઈમામ મુહમ્મદ رَحْمَةُ اللّٰهِ تَعَالٰی عَلَیْہِ જબ બારગાહે સય્યિદુના ઈમામે આ'ઝમ અબૂ હનીફા رَحْمَةُ اللّٰهِ تَعَالٰی عَلَیْہِ મેં પઢને કે લિયે હાઝિર હુએ તો બે રીશ ઓર અમ્રદે હસીન થે, સય્યિદુના ઈમામે આ'ઝમ

ફરમાને મુસ્તકા طي الله تعالى عليه وآله وسلم : जिस ने मुझ पर रोझे जुमुआ दो सो बार दुइडे पाक पढा उस के दो सो साल के गुनाह मुआफ़ होंगे. (क्रमल)

અબૂ હનીફા رَحْمَةُ اللهِ تَعَالَى عَلَيْهِ نے उन کو હુકમ દિયા કે પહલે કુરઆને કરીમ હિફઝ કર લીજિયે, વોહ એક હફ્તે કે બા'દ ફિર ઇલ્મે દીન હાસિલ કરને કે લિયે હાઝિર હો ગએ, ફરમાયા : મેં ને કહા થા હિફઝ કર લીજિયે લેકિન આપ ફિર આ ગએ ! અર્ઝ કી : હુઝૂર ! તા'મીલે ઇશાદ મેં હિફઝ કર કે હી હાઝિર હુવા હૂં. એક હફ્તે મેં કુરઆને કરીમ હિફઝ કર લેને કા સુન કર ઇમામે આ'ઝમ رَحْمَةُ اللهِ تَعَالَى عَلَيْهِ उन की जिहानत और कुव्वते હાફિઝા સે બેહદ મુ-તઅસ્સિર હુએ મગર उन की कशिश में कभी लाने की गरज से उन के वालिदे माजिद से ફરમાયા : ઇન કા સર મુંડવા દીજિયે ઓર ઇનહેં પુરાને કપડે પહનાઈયે, વોહ સર મુંડવા કર હાઝિર હુએ તબ ભી ખોફે ખુદા કે બાઈસ સચ્ચિદુના ઇમામે આ'ઝમ અબૂ હનીફા رَحْمَةُ اللهِ تَعَالَى عَلَيْهِ उन को अपने सामने नहीं बल्के अपनी पीठ या सुतून के पीछे बिठा कर पढाते ता के उन पर नजर न पड़े. (مُلْتَقَطًا مِنَ الْمَنَاقِبِ)

للكردي ج ٢ ص ١٤٧، ١٥٥، رَدُّ الْمُحْتَار ج ٩ ص ٦٠٣، شذرات الذهب لابن العماد ج ٢ ص ١٧)

આંખોં મેં સરે હશર ન ભર જાએ કહી આગ

આંખોં પે મેરે ભાઈ લગા કુફલે મદીના

(વસાઈલે બખ્શિશ, સ. 116)

અમરદ કી પહયાન

ઇસ ઇમાન અફરોઝ હિકાયત સે મુદરિસીન કે સાથ સાથ અમરદોં કો ભી દર્સે ઇબ્રત હાસિલ કરના ચાહિયે. અમરદ કો આમ તૌર પર અપને અમરદ હોને કા એહસાસ નહીં હોતા. જિન કી દાઢી નિકલ કર જબ તક પૂરે ચેહરે પર ખૂબ નુમાયાં ઓર ઘની નહીં હો જાતી વોહ ઉમૂમન અમરદ હોતે હૈં, બા'ઝ 22 સાલ તક અમરદ રહતે હૈં ઓર બા'ઝોં કે પૂરે ચેહરે પર ઘની

કરમાને મુસ્તફા ﷺ : عَلَى اللَّهِ تَعَالَى عَلَيْهِ وَالْوَسْمُ : મુઝ પર દુરુદ શરીફ પઢો અલ્લાહ ઠુઝુલ્ તુમ પર રહમત ભેજેગા. (૫૮/૧)

દાઢી નહીં આતી તો વોહ 25 સાલ યા ઈસ સે ભી ઝાઈદ ઉઝ તક અમ્રદ રહતે હૈં. અમ્રદ કે ઈલાવા ભી અગર કિસી મર્દ મ-સલન અમ્રદ કે બડે ભાઈ યા બાપ બલ્કે દાદા કો દેખ કર શહૂવત આતી હો ઔર “ગન્દી લઝ્ઝત” કે સાથ બાર બાર ઉસ કી તરફ નઝર ઉઠતી હો તો અબ વોહ દેખા જાને વાલા મર્દ યાહે બુઢ્ઢા હો ઉસે શહૂવત કે સાથ દેખના હરામ હૈ.

દેખના હૈ તો મદીના દેખિયે

કસ્રે શાહી કા નઝારા કુછ નહીં

અમ્રદ કો તોહફા દેના કેસા ?

દા'વતે ઈસ્લામી કે ઈશાઅતી ઈદારે મક-ત-બતુલ મદીના કી મત્બૂઆ 397 સફહાત પર મુશ્તમિલ કિતાબ, “પર્દે કે બારે મેં સુવાલ જવાબ” સફહા 330 સે એક મુફીદ સુવાલ જવાબ મુલા-હઝા હો :

સુવાલ : મર્દ કા શહૂવત કી વજહ સે અમ્રદ સે દોસ્તી રખના ઔર ઉસ કો મઝીદ હિલાને કે લિયે તોહફા વ દા'વત કા સિલ્સિલા રખના કેસા હૈ ?

જવાબ : એસી દોસ્તી ના જાઈઝ વ હરામ હૈ બલ્કે ફુ-કહાએ કિરામ (دُرُّمُخْتَار ج ٢ ص ٩٨، تفسيرات احمدية ص ٥٥٩) ભી હરામ હૈ. “અમ્રદ કી તરફ શહૂવત સે દેખના ભી હરામ હૈ.” ઔર શહૂવત કી વજહ સે અમ્રદ કો તોહફા દેના યા ઉસ કી દા'વત કરના ભી હરામ ઔર જહન્નમ મેં લે જાને વાલા કામ હૈ.

ફરમાને મુસ્તફા صَلَّی اللہُ تَعَالٰی عَلَیْہِ وَاٰلِہٖ وَسَلَّم : મુઝ પર કસરત સે દુરૂદે પાક પઢો બેશક તુમ્હારા મુઝ પર દુરૂદે પાક પઢના તુમ્હારે ગુનાહો કે લિયે મગફિરત હે. (મુસ્નદ)

“મોહતાત બન્દા સુખી રહતા હૈ” કે ઉન્નીસ હુરફ કી નિસ્બત સે અમ્રદ કે લિયે એહતિયાત કે 19 મ-દની ફૂલ (પેશ કર્દા એહતિયાતોં કી વજહ સે બિલા મસ્લહતે શર-ઈ વાલિદૈન યા ઘર વાલોં કી નારાઝી મોલ ન લેં)

❁ લડકે કે લિયે આફિઝ્યત ઈસી મેં હૈ કે અપને સે બડી ઉમ્મ વાલે સે દૂર રહે. બહુત નાઝુક દૌર હૈ ﷺ આજકલ બા’ઝ અવકાત “બાપ બેટી” નીઝ છોટે ઔર બડે સગે ભાઈયોં કે “આપસી ગન્દે મુઆ-મલાત” કી લરઝા ખૈઝ ખબરેં ભી સુની જાતી હૈં ❁ યકીનન હર બડા ફર્દ છોટે ફર્દ કે હક મેં “બુરા” નહીં હોતા, તાહમ આપ કિસી “બડે” સે દોસ્તી ગાંઠ કર ઉસ કો ઔર ખુદ કો બરબાદી કે ખતરે મેં મત ડાલિયે ❁ બાલિગ અમ્રદ ભી આપસ મેં બે તકલ્લુફ હો કર એક દૂસરે કો દબોચને, ઉઠાને, પટખ્ને, ગલે મેં હાથ ડાલ કર ચિપટાને વગૈરા હ-ર-કતેં કર કે શૈતાન કા ખિલોના ન બનેં. શહૂવત કે સાથ અમ્રદ કા ભી ઈસ તરહ કી હ-ર-કતેં કરના હરામ હૈ ❁ બિલા મસ્લહતે શર-ઈ અપને સે બડોં કે સાથ “બહુત ઝિયાદા મિલન-સારી” કા મુઝા-હરા ન ફરમાએં, વરના “આઝમાઈશ” મેં પડ સકતે હૈં ❁ અગર કિસી “બડે” કો ખ્વાહ વોહ ઉસ્તાઝ હી ક્યૂં ન હો અપને અન્દર ગૈર ઝરૂરી દિલચસ્પી લેતા, બાર બાર તોહફે દેતા, બે જા તા’રીફેં કરતા ઔર ઈસી ઝિમ્ન મેં આપ કો “છોટા ભાઈ” કહતા પાએં તો ખૂબ મોહતાત હો જાઈયે ❁ અમ્રદ કો (યા’ની 22 સાલ સે છોટે કો ઔર અગર 25 સાલ યા ઈસ સે ઝાઈદ ઉમ્મ કે બા વુજૂદ અમ્રદે હસીન હો તો

ફરમાને મુસ્તફા صَلَّی اللہُ عَلَیْہِ وَاٰلِہٖ وَسَلَّم : જો મુઝ પર એક દુરુદ શરીફ પઢતા હૈ અલ્લાહ عَزَّوَجَلَّ ઉસ કે લિયે એક કીરાત અજર લિખતા હૈ ઓર કીરાત ઉહુદ પહાડ જિતના હૈ. (Tirmidhi)

ઉસ કો ભી) મ-દની કાફિલે મેં સફર કી ઈજાઝત નહીં, અગર કોઈ બડા ઈસ્લામી ભાઈ અપને સાથ સફર કરને કે લિયે ઈસ્સાર કરે ઓર સફર કા ખર્ચ ભી પેશ કરે તો મ-દની મર્કઝ કે હુકમે મુમા-ન-અત કી તરફ ઉસ કી તવજજોહ દિલા દે ફિર ભી અગર મુસિર હો (યા'ની ઈસ્સાર કરે) તો ઉસ “બડે” સે ખૂબ મોહતાત હો જાઈયે ❀ બડે ઈસ્લામી ભાઈયોં સે બેશક અલગ થલગ રહિયે, મગર ખ્વાહ મ ખ્વાહ કિસી પર બદ ગુમાની કર કે, ગીબતોં, તોહમતોં ઓર મ-દની માહોલ કો ખરાબ કરને વાલી હ-ર-કતોં મેં પડ કર અપની આખિરત દાવ પર ન લગાઈયે ❀ ઈદ કે દિન ભી લોગોં સે ગલે મિલને સે બચિયે, મગર કિસી કો ઝિડકિયે નહીં. હિકમતે અ-મલી કે સાથ કતરા કર આગે પીછે હો જાઈયે, અમ્રદ ભી એક દૂસરે સે ગલે ન મિલેં ❀ વાલિદૈન ઓર નાના દાદા વગૈરા ખાનદાન કે બુઝુર્ગોં કે ઈલાવા કિસી કે સર યા પાઉં વગૈરા મત દબાએં નીઝ કિસી ઈસ્લામી ભાઈ કો અપના સર યા પાઉં દબાને દેં ન હાથ ચૂમને દેં ❀ કોઈ પરહેઝ ગાર, ખ્વાહ રિશ્તેદાર બલ્કે ઉસ્તાઝ હી ક્યૂં ન હો એહતિયાત ઈસી મેં હૈ કે હર બડે કે સાથ બલ્કે અમ્રદ ભી અમ્રદ કે સાથ તન્હાઈ સે બચે. હાં વાલિદ, સગે ભાઈ વગૈરા કે સાથ કોઈ માનેઅ ન હો તો તન્હાઈ મેં મુઝા-યકા નહીં ❀ મદ્રસે વગૈરા મેં કઈ અફરાદ જબ એક કમરે મેં સોએં તો અમ્રદ વ ગૈર અમ્રદ સભી કો ચાહિયે કે પાજામે કે ઊપર તહબન્દ બાંધ લેં ન હો તો કોઈ ચાદર લપેટ કર પર્દે મેં પર્દા કર કે, હર દો કે દરમિયાન મુનાસિબ ફાસિલા રખેં ઓર મુઝિન હો તો બીચ મેં કોઈ તકિયા યા બેગ વગૈરા બડી ચીઝ આડ બના લેં. ઘર મેં બલ્કે અકેલે મેં ભી પર્દે મેં પર્દા કર કે સોને કી આદત બનાએં, મ-દની કાફિલે ઓર ઈજતિમાઅ વગૈરા મેં ભી સોતે વક્ત

ફરમાને મુસ્તફા ﷺ : طَلَى اللّٰهُ تَعَالَى عَلَيْهِ وَالْوَالِدُونَ عَلَيْهِمُ السَّلَامُ : जिस ने किताब में मुज पर दुइडे पाक लिखा तो जब तक मेरा नाम उस में रहेगा फिरश्ते उस के लिये ईस्तिफ़ार करते रहेंगे. (अ/म)

ઈસી તરહ કરે ❀ જબ ભી બૈઠેં પઠેં મેં પઠાં લાઝિમી કીજિયે ❀ બને સંવરે રહને સે ઈજતિનાબ ફરમાઈયે. ઈસી રિસાલે કે સફહા 25 તા 26 પર દી હુઈ ઈમામે આ'ઝમ عَلَيْهِ رَحْمَةُ اللّٰهِ الْكَرِيمِ કી હિકાયત કી રોશની મેં અમ્રદ કા હલક કરવાતે (યા'ની સર મુંડવાતે) રહના ભી મુનાસિબ હૈ ઓર અગર સુન્નત કી નિયત સે ઝુલ્ફેં રખની હોં તો આધે કાન સે ઝાઈદ ન રખે ❀ ગોટા કનારી વાલે જાઝિબે નઝર બડે ઈમામે કે બજાએ સસ્તે કપડે કા સાદા સા છોટા ઈમામા શરીફ ઓર વોહ ભી ખૂબ સૂરત અન્દાઝ મેં બાંધને કે બજાએ કદરે ઢીલા સા બાંધિયે ❀ ઈમામા શરીફ પર નકશે ના'લે પાક વગૈરા ન લગાઈયે કે ઈસ તરહ લોગોં કી નિગાહેં ઉઠતીં ઓર બા'ઝોં કે લિયે “બદ નિગાહી” કા સામાન હોતા હૈ ❀ ચેહરે પર **CREAM** યા પાઉડર હરગિઝ હરગિઝ મત લગાઈયે ❀ ઝરૂરત હો તો હત્તલ ઈમ્કાન સસ્તે વાલા સાદા સા એનક ઈસ્તિ'માલ કીજિયે, ઘાત કી ખૂબ સૂરત ફેમ લગા કર દૂસરોં કે લિયે બદ નિગાહી કે ગુનાહ કા સબબ મત બનિયે ❀ બદબૂ સે બચના હી યાહિયે, લિહાઝા ઈત્ર બેશક લગાઈયે મગર વોહ કે જિસ કી ખુશબૂ ન ફેલે ❀ અપને લિબાસ વ અન્દાઝ મેં હર ઉસ મુબાહ ચીઝ (યા'ની જાઈઝ ચીઝ જિસ કા કરના સવાબ હો ન ગુનાહ મ-સલન ઈસ્ત્રી કિયે હુએ કપડે વગૈરા) સે ભી બચને કી કોશિશ ફરમાઈયે જિસ સે લોગ મુ-તવજજેહ હો કર ﷻ બદ નિગાહી કે ગુનાહ મેં પડ સકતે હોં. (ઈમામે આ'ઝમ عَلَيْهِ رَحْمَةُ اللّٰهِ تَعَالَى ને અપને અમ્રદ શાગિર્દ કે લિયે સર મુંડવાને ઓર પુરાના લિબાસ પહનાને કા હુકમ ફરમાયા ઈસે ખૂબ ઝેહન મેં રખિયે)

મ-દની ઈસ્તિજા : વાલિદૈન ઓર અસાતિઝા વગૈરા કો ભી યાહિયે કે

इरमाने मुस्तका : طَلَى اللّٰهُ تَعَالَى عَلَيْهِ وَالْوَسْمُ : जिस ने मुज पर अेक बार दुइडे पाक पढा अल्लाह उंस पर दस रडमतें बेजता है. (स्)

मजकुरा म-दनी झूलों की रोशनी में अम्रदों को हर तरह की “टिपटोप” से बयने का जेहन दें.

अम्रद का ना'त शरीफ पढना

अम्रद को दूसरों के साथ मिल कर ना'त शरीफ पढाने से बयना मुनासिब है. युनान्थे दा'वते ईस्लामी के ईशाअती ईदारे मक-त-अतुल मदीना की मत्बूआ 561 सईहात पर मुशतमिल किताब, “मल्कूआते आ'ला हजरत” सईहा 545 पर है : अर्ज : भीलाद ज्वां (या'नी ना'त शरीफ पढने वाले) के साथ अगर अम्रद शामिल हों येह कैसा है ? ईशा'द : “नहीं याहिये.” (मल्कूआते आ'ला हजरत, स. 545) काश ! अम्रद सिई अकेले या अपने घर के अइराद ही में ना'त शरीफ पढ लिया करे, كَرَّمَ اللهُ وَجْهَهُ كَرَّمَ اللهُ وَجْهَهُ करम बालाअे करम होग। सब के सामने जब अम्रद ना'त शरीफ पढता है तो बा'ज लोगों का बढ निगाही के गुनाह से बयना ईन्तिहाई मुश्किल हो जाता है और यूं भी तरन्नुम और राग से पढने में अेक तरह का ज़हू होता है. आशिके रसूल के लिये तो अकेले में ना'त शरीफ पढने का लुत्फ ही कुछ और होता है !

दिल में हो याद तेरी गोशअे तन्हाई हो

इर तो पलवत में अजब अन्जुमन आराई हो

हेंड प्रेक्टिस का अजाब

मर्द या औरत का हेंड प्रेक्टिस करना हराम है, अैसा करने वाले पर हदीसे मुबा-रका में ला'नत की गई है. इकीह अबुल्लैस समर कन्दी عَلَيْهِ رَحْمَةُ اللّٰهِ الْكَوَى की बयान कर्दा अेक हदीसे पाक में सात गुनहगार अइराद के अजाब का तजकिरा है उन में अेक मुशत जनी करने

ફરમાને મુસ્તકા : صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ : જો શખ્સ મુઝ પર દુરુદ પાક પઢના ભૂલ ગયા વોહ જન્ત કા રોસ્તા ભૂલ ગયા. (ખરૂન)

વાલા ભી હૈ કે બરોઝે કિયામત ઈસ પર અલ્લાહ તઆલા ન નઝરે રહમત ફરમાએગા ઓર ન હી ઉસે પાક કરેગા બલકે ઉસે સીધા જહન્નમ મેં જાને કા હુકમ દિયા જાએગા. (تَنْبِيهُ الْغَافِلِينَ ص ۱۳۷) આ'લા હઝરત ઈમામ અહમદ રઝા ખાન عَلَيْهِ رَحْمَةُ الرَّحْمَنِ એક સુવાલ કે જવાબ મેં ફરમાતે હૈં : (મુશ્ત ઝની કરને વાલા) ગુનહગાર હૈ આસી હૈ, ઈસ્સાર કે સબબ મુર-તકિબે કબીરા હૈ, ફાસિક હૈ. મઝીદ ફરમાતે હૈં : જો મુશ્ત ઝની (યા'ની હેંડ પ્રેક્ટિસ Hand practice) કરતે હૈં અગર વોહ બિગૈર તૌબા કિયે મર ગએ તો બરોઝે કિયામત ઈસ હાલ મેં ઉઠેંગે કે ઉન કી હથેલિયાં ગાભન (યા'ની હામિલા) હોંગી જિસ સે લોગોં કે મજમએ કસીર મેં ઉન કી રુસ્વાઈ હોગી.

(મુલખ્ખસ અઝ ફતાવા ર-ઝવિયા, જિ. 22, સ. 244)

બરબાદ જવાની

ગુનાહોં કે સૈલાબ કી હલાકત સામાનિયાં ! ફહ્હાશી ઓર ઉરયાની (યા'ની બે હયાઈ ઓર બે પદ્દગી) કા તૂફાન, મખ્લૂત તા'લીમી નિઝામ, મદોં ઓર ઓરતોં કા ઈખ્તિલાત યા'ની મેલજોલ, T.V. ઓર ઈન્ટરનેટ પર ફિલ્મોં, ડિરામે ઓર શહ્વત અફઝા મનાઝિર, રસાઈલ વ જરાઈદ કે **SEX APPEAL** મઝામીન વગૈરા ને મિલજુલ કર આજ કે નૌ જવાન કો બાવલા બના ડાલા હૈ ! હઝરતે સય્યિદુના ઝૈદ બિન ખાલિદ رَضِيَ اللهُ تَعَالَى عَنْهُ સે મરવી હૈ : “الْشَّبَابُ شُعْبَةٌ مِنَ الْجُنُونِ” યા'ની જવાની દીવાનગી હી કા એક શો'બા હૈ. (مسندُ الشَّهَابِ ج ۱ ص ۱۰۰ حدیث ۱۱۶) આજ કે નૌ જવાન પર શૈતાન ને અપના ઘેરા તંગ કર દિયા હૈ, ખ્વાહ વોહ બઝાહિર નમાઝી ઓર સુન્નતોં કા આદી હી કયૂં ન હો, અપની શહ્વત કી તસ્કીન કે લિયે મારા મારા ફિર રહા હૈ, મુઆ-શરા અપને ગલત રસ્મો રવાજ કે બાઈસ બેચારે કી શાદી

ફરમાને મુસ્તકા : صَلَى اللّٰهُ تَعَالَى عَلَیْهِ وَاٰلِهِ وَسَلَّمَ : जिस के पास मेरा जिक्र हुआ और उस ने मुझ पर दुर्दे पाक न पढा तबकीक वोह बदनप्त हो गया. (उंर)

में बहुत बड़ी દીવાર બન ચુકા છે, ઇમ્તિહાન, સપ્ત ઇમ્તિહાન છે, મગર ઇમ્તિહાન સે ઘબરાના મર્દોં કા શેવા નહીં. સબ્ર કર કે અજૂર લૂટના યાહિયે કે શહૂવત જિતની ઝિયાદા તંગ કરેગી સબ્ર કરને પર સવાબ ભી ઉતના હી ઝિયાદા મિલેગા. અગર શહૂવત કી તસ્કીન કે લિયે ના જાઈઝ ઝરાએઅ ઇખ્તિયાર કિયે તો દોનોં જહાનોં કા નુક્સાન ઔર જહન્નમ કા સામાન છે. હઝરતે સચ્ચિદુના અબૂ દરદા અલ્ઝહુ કબીર લીબેહી વ ૧૦૭ હદીથ ૩૬૬)

કા બાઈસ હોતી છે.”

પૈગામે હયા

યેહ લિખતે હુએ કલેજા કાંપતા ઔર હયા સે કલમ થર્તાતા છે, મગર મેરી ઇન મા'રૂઝાત કો બે હયાઈ પર મબ્ની નહીં કહા જા સકતા બલકે યેહ તો ઐન દર્સે હયા છે. “અલ્લાહ ઈબ્રાહીમ રહા છે.” યેહ ઇમાન રખને કે બા વુજૂદ જો લોગ અપને ઝો'મે ફાસિદ (યા'ની નાકિસ ખયાલ) મેં “છુપ કર” બે હયાઈ કા કામ કરતે હેં ઉન કે લિયે હયા કા પૈગામ છે. આહ ! ગન્દી ઝેહ્નિચ્ચત કે હામિલ કઈ નૌ જવાન (લડકે ઔર લડકિયાં) શાદી કી રાહેં મસ્ફૂદ (યા'ની બન્દ) પા કર અપને હી હાથોં અપની જવાની બરબાદ કરના શુરૂઅ કર દેતે હેં. ઇખ્તિદાઅન અગર્યે લુત્ફ આતા હો, મગર જબ આંખ ખુલતી (યા'ની એહસાસ બેદાર હોતા) છે તો બહુત દેર હો ચુકી હોતી છે. યાદ રહે ! યેહ ફે'લ હરામ વ ગુનાહ છે ઔર હદીસે પાક મેં ઐસા કરને વાલે કો “મલૂન” કહા ગયા છે ઔર વોહ જહન્નમ કે દર્દનાક અઝાબ કા હકદાર છે. આખિરત ભી દાવ પર લગી ઔર દુન્યા મેં ભી ઈસ કે સપ્ત તરીન નુક્સાનાત હેં, ઈસ ગૈર ફિત્રી અમલ સે સિહ્હત ભી તબાહ વ બરબાદ હો કર રહ જાતી છે.

करमाने मुस्तक़ा : طَلَى اللّٰهُ غَالِي عَلَيْهِ وَالْوَسْمُ : जिस ने मुज़ पर दस भरतबा सुब्द और दस भरतबा शाम दुइडे पाक पढा
 (उसे क्रियामत के दिन मेरी शक्रायत भिवेगी. (19/18))

એક બાર એહ “ફે’લ” કર લેને કે બા’દ ફિર કરને કો જી
 યાહતા હૈ, અગર **مَدَّ اللّٰهُ عَزَّوَجَلَّ** ચન્દ બાર કર લિયા તો વરમ આ જાતા
 હૈ ઓર ઉઝ્વ કી નર્મ વ નાઝુક રગેં રગડ ખા કર દબ કર સુસ્ત હો
 જાતીં ઓર પક્ટે બેહદ હુસ્સાસ હો જાતે હેં ઓર બિલ આખિર નૌબત
 યહાં તક પહોંચતી હૈ કે ઝરા બદ નિગાહી હુઈ બલકે ઝેહૂન મેં તસવ્વુર
 કાઈમ હુવા ઓર મની ખારિજ, બલકે કપડે સે રગડ ખા કર હી મની
 ઝાએઅ. “મની” ઉસ ખૂન સે બનતી હૈ, જો તમામ જિસ્મ કો ગિઝા
 પહોંચાને કે બા’દ બચ જાતા હૈ. જબ એહ કસરત કે સાથ ખારિજ
 હોને લગેગી તો ખૂન બદન કો ગિઝા કેસે ફરાહમ કરેગા? નતીજતન
 જિસ્મ કા સારા નિઝામ દરહમ બરહમ.

હેંડ પ્રેક્ટિસ કી 26 જિસ્માની આફતેં

﴿1﴾ દિલ કમઝોર ﴿2﴾ મે’દા ﴿3﴾ જિગર ઓર ﴿4﴾ ગુદે
 ખરાબ ﴿5﴾ નઝર કમઝોર (6) કાનોં મેં શાએં શાએં કી આવાઝેં
 આના ﴿7﴾ ચિડચિડા પન ﴿8﴾ સુબ્હ ઉઠે તો બદન સુસ્ત ﴿9﴾ જોડ
 જોડ મેં દર્દ ઓર આંખેં ચિપકી હુઈ ﴿10﴾ “મની” પતલી પડ જાને કે
 સબબ થોડી થોડી રતૂબત બહતી રહના, નાલી મેં રતૂબત પડી રહના
 ઓર સડના ફિર ઉસ કે સબબ સે બા’ઝ અવકાત ઝખ્મ હો જાના
 ઓર ઉસ મેં પીપ પડ જાના ﴿11﴾ શુરૂઅ મેં પેશાબ મેં મા’મૂલી જલન
 ﴿12﴾ ફિર મવાદ નિકલના ﴿13﴾ ફિર જલન મેં ઈઝાફા ﴿14﴾ યહાં
 તક કે પુરાના સોઝાક (યા’ની પેશાબ મેં જલન વ પીપ નિકલતે રહને)
 સે ઝિન્દગી એસી તલ્ખ હો જાતી હૈ કે આદમી મૌત કી આરઝૂ કરને
 લગતા હૈ ﴿15﴾ “મની” કા પતલી હોને કે સબબ બિલા કિસી ખયાલ

ફરમાને મુસ્તફા صَلَّی اللہُ تَعَالٰی عَلَیْہِ وَاٰلِہٖ وَسَلَّمَ : જિસ કે પાસ મેરા ઝિક હુવા ઓર ઉસ ને મુઝ પર દુરૂદ શરીફ ન પઢા ઉસ ને જકા કી. (જા/ખ)

કે પેશાબ સે પહલે યા બા'દ પેશાબ મેં મિલ કર નિકલ જાના. ઈસી કો “જિરયાન” કહતે હૈં, જો શદીદ તરીન અમરાઝ કી જડ હૈ ‹‹16›› ઉઝ્વ મેં ટેઢાપન ‹‹17›› ઢીલાપન ‹‹18›› જડ કમઝોર ‹‹19›› શાદી કે કાબિલ ન રહના ‹‹20›› અગર જિમાઅ મેં કામ્યાબ ભી હો ગયા તો ઓલાદ કી ઉમ્મીદ નહીં ‹‹21›› કમર મેં દર્દ ‹‹22›› ચેહરા ઝર્દ ‹‹23›› આંખોં મેં ગઢે ‹‹24›› શક્લ વહ્શિયાના ‹‹25›› તપે દિક (યા'ની પુરાના બુખાર જો ઉમૂમન ફેફડોં કે ખરાબ હોને કી વજહ સે આતા હૈ. T.B.) ‹‹26›› પાગલ પન.

હેંડ પ્રેક્ટિસ કરને વાલા હર પાંચવાં ફર્દ પાગલ

એક ઈતિલાઅ કે મુતાબિક જબ એક હઝાર તપે દિક (T.B.) કે મરીઝોં કે અસ્બાબે મરઝ પર ગૌર ક્રિયા ગયા તો ચેહ બાત સામને આઈ કે 414 મુશ્ત ઝની કે સબબ, 186 કસ્રતે જિમાઅ કે બાઈસ ઓર બક્રિયા દીગર વુજૂહાત કી બિના પર મુબ્તલાએ તપે દિક હુએ થે. 124 પાગલોં કા ઈમ્તિહાન કરને પર મા'લૂમ હુવા કે ઈન મેં સે 24 (યા'ની તકરીબન હર પાંચવાં ફર્દ) અપને હાથ સે મની ખારિજ કરને કી બિના પર પાગલ હુવા થા.

“સબ્ર કર” કે પાંચ હુરૂફ કી નિસ્બત સે

ઇસ ગુનાહ સે બચને કે 5 રહાની ઇલાજ

હુસ્ને એ'તિકાદ ઓર અચ્છી નિચ્ચત સે જો ચેહ આ'માલ બજા લાએગા ﴿۱﴾ હેંડ પ્રેક્ટિસ કી મુસીબત સે નજાત પાએગા ‹‹1›› જો ભી (મર્દ યા ઓરત) ﴿۱﴾ ઈસ ગન્દે ફે'લ મેં

ફરમાને મુસ્તફા ﷺ : عَلَى اللَّهِ تَعَالَى عَلَيْهِ وَالْوَالِدِينَ : જો મુઝ પર રોઝે જુમુઆ દુરૂદ શરીફ પઢેગા મેં કિયામત કે દિન ઉસ કી શકાઅત કરેગા. (ક્રમ્લ))

મુખ્તલા હો, વોહ દો રક્ઝત નમાઝે તૌબા અદા કર કે સચ્ચે દિલ સે તાઈબ હો ઔર આયન્દા યેહ ગુનાહ ન કરને કા પક્કા અહ્દ કરે ઔર તૌબા પર ઈસ્તિકામત કી ગિડગિડા કર દુઆ માંગે ﴿2﴾ કસરત સે રોઝે રખે, **﴿3﴾** **إِنْ شَاءَ اللَّهُ عَزَّوَجَلَّ** શહ્વત મગ્લૂબ (યા'ની કન્ટ્રોલ) હોગી **﴿3﴾** મુસલ્સલ 41 રોઝ તક 111 બાર **يَا مُؤْمِنُ** કા વિર્દ કરે. (અવ્વલ આખિર ત્રીન બાર દુરૂદ શરીફ પઢે) **﴿4﴾** સોતે વક્ત લૈટે હુએ **يَا مُؤْمِنُ** કા વિર્દ કરતે કરતે સો જાએ. **﴿5﴾** **إِنْ شَاءَ اللَّهُ عَزَّوَجَلَّ** ફાએદા હોગા. (જબ ભી લૈટે લૈટે કુછ પઢેં તો પાઉં સિમટે હુએ હોને ચાહિએ) **﴿5﴾** રોઝાના સુબ્હ (અવ્વલ આખિર ત્રીન બાર યા એક બાર દુરૂદ શરીફ ઔર) 11 બાર સૂ-રતુલ ઈખ્લાસ પઢે, શૈતાન મઅ લશ્કર ભી **﴿6﴾** **إِنْ شَاءَ اللَّهُ عَزَّوَجَلَّ** ગુનાહ ન કરવા સકે જબ તક યેહ (પઢને વાલા) ખુદ ન કરે. (આધી રાત કે બા'દ સે લે કર સૂરજ કી પહલી કિરન ચમકને તક સુબ્હ કહલાતી હૈ)

“**يَا كَرِيمُ**” કે છ હુરફ કી નિસ્બત સે ઘસ ગુનાહ સે બચને કી 6 તદબીરેં

﴿1﴾ અમ્રદ પસન્દી, બદ નિગાહી ઔર હેંડ પ્રેક્ટિસ કે અઝાબાત ઔર દુન્યવી નુક્સાનાત પર ગૌર કરે ઔર ખુદ કો ખૂબ ડરાએ **﴿2﴾** જિસ કો શહ્વત તંગ કરતી હો, વોહ ફૌરન શાદી કર લે **﴿3﴾** શાદી શુદા કા પરદેસ મેં નોકરી યા કારોબાર વગૈરા કે લિયે ચાર માહ સે ઝિયાદા અપની ઝૌજા સે દૂર રહના (મિયાં બીવી દોનોં કે લિયે) ઈન્તિહાઈ ખતરનાક હૈ, દૂરી કે સબબ દોનોં ઈસ ફે'લે બદ મેં મુખ્તલા હો કર દુન્યા વ આખિરત બરબાદ કર બૈઠેં તો તઅજજુબ નહીં. આ'લા હઝરત **رَحْمَةُ اللَّهِ تَعَالَى عَلَيْهِ** ફતાવા

ફરમાને મુસ્તફા صَلَّی اللہُ تَعَالٰی عَلَیْہِ وَاٰلِہٖ وَسَلَّم : મુઝ પર દુરૂદે પાક કી કસરત કરો બેશક યેહ તુમહારે લિયે તહારત હૈ. (મુબીન)

ર-ઝવિયા જિલ્દ 23 સફહા 388 પર ફરમાતે હૈં : બિલા ઝરુરત સફર મેં ઝિયાદા રહના કિસી કો ન ચાહિયે, હદીસ મેં હુકમ ફરમાયા હૈ કે “જબ કામ હો ચુકે સફર સો જલ્દ વાપસ આઓ.” [مُسْلِم ص ۱۰۶۳ حدیث ۱۹۲۷] ઓર જો વતન મેં ઝોજા છોડ આયા હો ઉસે હુકમ હૈ કે જહાં તક બન પડે ચાર માહ કે અન્દર અન્દર વાપસ આએ (કે અમીરુલ મુઅમિનીન હઝરતે સચ્ચિદુના ઉમર ફારૂકે આ’ઝમ રَضِیَ اللہُ تَعَالٰی عَنْہُ ને મુસલ્માનોં કો યેહી હુકમ ફરમાયા થા) ﴿4﴾ હર ઉસ કામ વ મકામ સે બયે જિસ સે શહ્વત કો તહરીક મિલતી હો મ-સલન જિન કામોં યા જગહોં પર અમરદોં સે વાસિતા પડતા હો ઉન સે દૂર રહે ﴿5﴾ ભાભી, તાઈ, ચચી, મુમાની, ચચાઝાદ, ખાલાઝાદ, મામૂઝાદ ઓર ફૂફીઝાદ કા શરઅન પદા હૈ, જો અલ્લાહ ઈન સે નિગાહેં ન બચાતા હો, બે તકલ્લુફ બનતા, હંસી મઝાક કરતા હો ઓર શહ્વત કી કસરત કી શિકાયત ભી કરતા હો વોહ અહ્મકોં કા સરદાર હૈ કે ખુદ હી આગ મેં હાથ ડાલતા ફિર ચિલ્લાતા હૈ કે બચાઓ ! બચાઓ ! મેરા હાથ જલા જાતા હૈ ! યેહી હાલ ફિલ્મેં, ડિરામે દેખને વાલે ઓર ગાને બાજે સુનને વાલે કા હૈ ﴿6﴾ રુમાની નાવિલેં, ઈશ્કિયા વ ફિસ્કિયા અફસાને ઓર ઈસી તરહ કે અખ્બારી મઝામીન, બલ્કે “ગન્દી ખબરોં” ઓર ઓરતોં કી તસ્વીરોં સે ભરપૂર અખ્બારાત પઢને સે ઈજતિનાબ કરે. વરના બદ નિગાહી સે ખુદ કો બચાના ઈન્તિહાઈ દુશ્વાર ઓર શહ્વત કી કસરત સે બચના મુશ્કિલ તરીન હોગા. કહા જાતા હૈ : “خود کرده راعلاجه نیست” યા’ની અપને હાથોં કે કિયે કા કોઈ ઈલાજ નહીં. (શહ્વત પરસ્તિયોં ઓર મર્દ વ ઓરત કી હેંડ પ્રેક્ટિસ કી જુદા જુદા તબાહ કારિયોં કી મઝીદ મા’લૂમાત કે લિયે ખલીફએ આ’લા હઝરત, મુબલ્લિગે ઈસ્લામ,

﴿فَرَمَانَهُ مُسْتَكْفًا صَلَّى اللَّهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ﴾ : तुम जहां भी हो मुझ पर दुर्रद पढ़ो के तुम्हारा दुर्रद मुझ तक
पहोचता है. (طبرانی)

हजरते मौलाना अब्दुल अलीम सिद्दीकी عَلَيْهِ رَحْمَةُ اللَّهِ الْقَوِي की मुफ्तसर
किताब “बहारे शबाब” का मुता-लआ इरमाईये)

छुप के लोगों से किये जिस के गुनाह वोह भबरदार है क्या होना है
काम जिन्दां के किये और हमें शौके गुलजार है क्या होना है
अरे ओ मुजरिमे बे परवा ! हेभ सर पे तलवार है क्या होना है
उन को रड्म आये तो आये वरना वोह कडी मार है क्या होना है

(हदाईके बफ्शिश शरीफ)

صَلُّوا عَلَى الْحَبِيبِ ! صَلَّى اللَّهُ تَعَالَى عَلَى مُحَمَّدٍ

تُوبُوا إِلَى اللَّهِ ! أَسْتَغْفِرُ اللَّهَ

صَلُّوا عَلَى الْحَبِيبِ ! صَلَّى اللَّهُ تَعَالَى عَلَى مُحَمَّدٍ

भीठे भीठे इस्लामी भाईयो ! बयान को इफ्तिताम की तरफ
लाते हुअे सुन्नत की इजीलत और यन्द सुन्नतें और आदाब बयान
करने की सआदत हासिल करता हूं. ताजदारे रिसालत, शहन्शाहे
नुबुव्वत, मुस्तफा जाने रहमत, शम्मे बजमे हिलायत, नोशअे बजमे
जन्नत صَلَّى اللَّهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ का इरमाने जन्नत निशान है : जिस ने
मेरी सुन्नत से मडब्बत की उस ने मुझ से मडब्बत की और जिस ने मुझ
से मडब्बत की वोह जन्नत में मेरे साथ होगी. (ابن عساکر ج ٩ ص ٣٤٣)

सीना तेरी सुन्नत का मदीना बने आका

जन्नत में पडोसी मुझे तुम अपना बनाना

صَلُّوا عَلَى الْحَبِيبِ ! صَلَّى اللَّهُ تَعَالَى عَلَى مُحَمَّدٍ

ફરમાને મુસ્તફા ﷺ : صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ : जिस के पास मेरा ठिक छो और वोह मुज पर दुइद शरीक न पढे तो वोह लोगो में से कजूस तरीन शप्स है. (त्रुभिये)

“नामे मुहम्मद मीठा लगता है” के अह्मरह दुइइ की निस्बत से नाम रफने के बारे में 18 म-दनी इल

❁ (1) अरबों

के नाम पर नाम रफो (५४ व ५५ हदित २३२९)

(2) कियामत के दिन तुम को तुम्हारे और तुम्हारे बापों के नाम से पुकारा जायेगा लिहाजा अपने अरबे नाम रफो

(अबुदावुद ज ६ व ३७ हदित ६९६४) ❁ सदरुशशरीअह, अदरुतरीकह

हजरते अल्लामा मौलाना मुफ्ती मुहम्मद अमजद अली आ'जमी

फरमाते हैं : अरबे का अरबना नाम रफा जाये, हिन्दूस्तान में बहुत लोगो के ऐसे नाम हैं जिन के कुछ मा'ना नहीं या उन के बुरे मा'ना हैं ऐसे नामों से अहतिराज (या'नी परहेज)

करें. अम्बियाअे किराम عَلَيْهِمُ الصَّلَاةُ وَالسَّلَام के अस्माअे तय्यिबा और सहाबा व ताबिअिन व अजुगानि दीन (رَضَوَانُ اللهُ تَعَالَى عَلَيْهِمْ أَجْمَعِينَ) के नाम

पर नाम रफना अहततर है, उम्मीद है के इन की अ-र-कत अरबे के शामिले हाल हो (अहारे शरीअत, जि. 3, स. 653) ❁ अरबना

जिन्दा पैदा हुवा या मुर्दा उस की अिल्कत (या'नी पैदाईश) तमाम (या'नी मुकम्मल) हो या ना तमाम (ना मुकम्मल) अहर हाल

उस का नाम रफा जाये और कियामत के दिन उस का अशर होगा (या'नी उठाया जायेगा) (अमख्तार ज ३ व १०६.१०७, अहारे शरीअत, जि. 1,

स. 841) मा'लूम हुवा जो अरबना करबना गिर जाये उस का ली नाम रफा जाये. जैसा के मक-त-अतुल मदीना के मत्बूआ रिसाले

ફરમાને મુસ્તફા صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ : उस शप्स की नाक पाक आवुद हो जिस के पास मेरा ठिक हो और वोह मुज पर दुइदे पाक न पड़े. (म)

“औलाह के हुकूक” सफ़हा 17 पर है : नाम रफ़े यहाँ तक के कय्ये बय्ये का त्मी जो कम दिनोँ का गिर जाये वरना अद्लाह عَزَّوَجَلَّ के यहाँ शाकी होगी. (या’नी शिकायत करेगी) इरमाने मुस्तफ़ा

صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ है : कय्ये बय्ये का नाम रफ़ो के अद्लाह तआला उस के जरीये तुम्हारी मीज़ान (या’नी अमल के तराजू) को त्मारी करेगी

(أَلْفِرْدَوْسُ بِمَأْثُورِ الْخُطَّابِ ۲۷ ص ۳۰۸ حدیث ۳۳۹۲) ❁ “मुहम्मद” नाम

रफ़ने के बारे में तीन इरामीने मुस्तफ़ा صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ : ﴿1﴾ जिस के लउका पैदा हो और वोह मेरी मलुबबत और मेरे नाम से ब-र-कत हासिल करने के लिये उस का नाम मुहम्मद रफ़े वोह और उस का लउका

दोनों जन्नत में जाओँ (جَمْعُ الْجَوَامِعِ ج ۷ ص ۲۹۰ حدیث ۲۳۲۰۰) ﴿2﴾ रोजे

कियामत दो शप्स अद्लाह عَزَّوَجَلَّ के हुजूर षडे किये जाओँगे, हुकूम

होगा : एन्हें जन्नत में ले जाओ. अर्ज़ करेंगे : एलाही عَزَّوَجَلَّ ! हम किस

अमल पर जन्नत के काबिल हुअे ? हम ने तो जन्नत का कोई काम किया

नहीं ! इरमाओगी : जन्नत में जाओ, मैं ने हलफ़ किया है के जिस का

नाम अहमद या मुहम्मद हो दोऊष में न जाओगी (इतावा र-अविय्या,

जि. 24, स. 687, ۹۰۰۶ حدیث ۵۳۰ ص ۵۰ ج ۵) ﴿3﴾ तुम में किसी

का क्या नुकसान है अगर उस के घर में अेक मुहम्मद या दो मुहम्मद

या तीन मुहम्मद हों (الطبقات الكبرى لابن سعد ج ۵ ص ۴۰) येह हदीसे पाक

नकल करने के बा’द आ’ला हजरत مُحَمَّدٌ اللهُ تَعَالَى عَلَيْهِ ने जो लिखा है

उस का ખुलासा है : एसी लिये मैं ने अपने सब बेटों, त्मतीजों

का अकीके में सिर्फ़ मुहम्मद नाम रफ़ा इर नामे मुबारक के आदाब

ફરમાને મુસ્તફા صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ : जिस ने मुज पर रोके जुमुआ हो सो बार दुरदे पाक पढा उस के दो सो साल के गुनाह मुआफ़ होगे. (त्राहल)

કી હિફાઝત ઓર બચ્ચોં કી પહચાન હો સકે ઈસ લિયે ઉર્ફ (યા'ની પુકારને વાલે નામ) જુદા મુકરર કિયે. بِحَمْدِ اللَّهِ પાંચ મુહમ્મદ અબ ત્તી મૌજૂદ હેં જબ કે પાંચ સે ઝાઈદ અપની રાહ કો ગએ યા'ની વફાત પા ચુકે હેં. (મુલખ્ખસ અઝ : ફતાવા ર-ઝવિયા, જિ. 24, સ. 689)

હુજજતુલ ઈસ્લામ હઝરતે સય્યિદુના ઈમામ અબૂ હામિદ મુહમ્મદ બિન મુહમ્મદ બિન મુહમ્મદ ગઝાલી عَلَيْهِ رَحْمَةُ اللَّهِ الْوَالِي کا अपना, वालिद साहिब का और दादाजान का मुबारक नाम मुहम्मद था या'नी मुहम्मद बिन मुहम्मद बिन मुहम्मद ❀ औलादे नरीना के लिये अमल : सय्यिदुना इमामे आ'उम अबू हनीफ़ा عَلَيْهِ رَحْمَةُ اللَّهِ تَعَالَى के उस्ताजे गिरामी जलीलुल कद्र ताबेई इमाम अता عَلَيْهِ رَحْمَةُ اللَّهِ تَعَالَى ફરમાते હેં : જો યાહે કે ઉસ કી ઓરત કે હમ્લ મેં લડકા હો, ઉસે યાહિયે અપના હાથ (હામિલા) ઓરત કે પેટ પર રખ કર કહે : अगर लडका है तो मैं ने इस का नाम मुहम्मद रखा. اِنْ شَاءَ اللَّهُ الْعَزِيزُ लडका ही होगा (फ़तावा र-ઝવિયા, જિ. 24, સ. 690) ❀ આજકલ આજકલ اللَّهُ مَعَادُ اللَّهِ નામ બિગાડને કી વબા આમ હે ઓર મુહમ્મદ નામ કા બિગાડના તો બહુત હી સખ્ત તકલીફ દેહ હે. લિહાઝા હર મર્દ કા નામ મુહમ્મદ યા અહમદ રખ લીજિયે ઓર ઉર્ફ યા'ની પુકારને કે લિયે મ-સલન બિલાલ રઝા, હિલાલ રઝા, જમાલ રઝા, કમાલ રઝા ઓર ઝૈદ રઝા વગૈરા રખ લિયા જાએ ❀ ફિરિશતોં કે મખ્સૂસ નામ પર નામ રખના દુરુસ્ત નહીં, લિહાઝા કિસી કા જિબ્રીલ યા મીકાઈલ વગૈરા નામ ન રખિયે. ફરમાને મુસ્તફા صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ હે : ફિરિશતોં કે નામ

ફરમાને મુસ્તફા صَلَّی اللہُ تَعَالٰی عَلَیْہِ وَاٰلِہٖ وَسَلَّم : મુઝ પર દુરૂદ શરીફ પઢો અલલાહ ઠુઝુલ તુમ પર રહમત ભેજેગા. (ابن عمری)

પર નામ ન રખો (شُعْبُ الْإِيمَان ج ٦ ص ٣٩٤ حدیث ٨٦٣٦) ❀ મુહમ્મદ નબી, અહમદ નબી, નબી અહમદ નામ રખના હરામ હૈ (મુલખ્ખસ અઝ ફતાવા ર-ઝવિયા, જિ. 24, સ. 677) ❀ જબ ભી નામ રખેં ઉસ કે મા'ના પર ગૌર કર લીજિયે યા કિસી આલિમ સે પૂછ લીજિયે, બુરે મા'ના વાલે નામ ન રખિયે મ-સલન ગફૂરૂદીન કે મા'ના હૈં : દીન કા મિટાને વાલા, યેહ નામ રખના સપ્ત બુરા હૈ ❀ બુરે નામ બુરી તાસીર રખતે હૈં યુનાન્થે આ'લા હઝરત رَحْمَةُ اللہِ تَعَالٰی عَلَیْہِ ફરમાતે હૈં : મૈં ને બુરે નામોં કા સપ્ત બુરા અસર પડતે અપની આંખોં સે દેખા હૈ, ભલે ચંગે સુન્ની સૂરત કો આખિરે ઉમ્ર મેં “દીન પોશ ઓર નાહક કોશ” (યા'ની દીન છુપાને વાલા ઓર બાતિલ કે લિયે કોશિશ કરને વાલા) હોતે પાયા હૈ. (મુલખ્ખસ અઝ ફતાવા ર-ઝવિયા, જિ. 24, સ. 681, 682) ❀ નામ કે અ-સરાત આયન્દા નસ્લ મેં ભી આ સકતે હૈં, “બહારે શરીઅત” જિલ્દ 3 સફહા 601 પર હદીસ નમ્બર 21 હૈ : “સહીહ બુખારી” મેં સઈદ બિન મુસય્યબ رَضِيَ اللہُ تَعَالٰی عَنْہُ સે મરવી કહતે હૈં : મેરે દાદા નબિય્યે કરીમ صَلَّی اللہُ تَعَالٰی عَلَیْہِ وَاٰلِہٖ وَسَلَّم કી ખિદમત મેં હાઝિર હુએ. હુઝૂર (صَلَّی اللہُ تَعَالٰی عَلَیْہِ وَاٰلِہٖ وَسَلَّم) ને પૂછા : તુમહારા કયા નામ હૈ ? ઉન્હોં ને કહા : હઝૂન. ફરમાયા : તુમ સહૂલ હો. યા'ની અપના નામ “સહૂલ” રખો કે ઈસ કે મા'ના હૈં નર્મ ઓર “હઝૂન” સપ્ત કો કહતે હૈં. ઉન્હોં ને કહા કે જો નામ મેરે બાપ ને રખા હૈ ઉસે નહીં બદલૂંગા. સઈદ બિન મુસય્યબ કહતે હૈં : ઈસ કા નતીજા યેહ હુવા કે હમ મેં અબ તક સપ્તી પાઈ જાતી હૈ (بخاری ج ٤ ص ١٠٣ حدیث ٦١٩٣)

કરમાને મુસ્તકા صَلَّی اللہُ تَعَالٰی عَلَیْہِ وَاٰلِہٖ وَسَلَّم : મુઝ પર કસરત સે દુરૂદે પાક પઢો બેશક તુમહારા મુઝ પર દુરૂદે પાક પઢના
 તુમહારે ગુનાહોં કે લિયે મગફિરત હે. (મુસ્લિમ)

❁ યાસીન યા તાહા નામ રખના મન્અ હૈ (ફતાવા ર-ઝવિયા, જિ. 24, સ. 680) મુહમ્મદ યાસીન નામ ભી નહીં રખ સકતે હાં ગુલામ યાસીન ઔર ગુલામ તાહા નામ રખના જાઈઝ હૈ ❁ બહારે શરીઅત હિસ્સા 15 “અકીકે કા બયાન” મેં હૈ : અબ્દુલ્લાહ વ અબ્દુરહમાન બહુત અચ્છે નામ હૈં મગર ઈસ ઝમાને મેં યેહ અક્સર દેખા જાતા હૈ કે બજાએ અબ્દુરહમાન ઉસ શખ્સ કો બહુત સે લોગ રહમાન કહતે હૈં ઔર ગૈરે ખુદા કો રહમાન કહના હરામ હૈ. ઈસી તરહ અબ્દુલ ખાલિક કો ખાલિક ઔર અબ્દુલ મા'બૂદ કો મા'બૂદ કહતે હૈં ઈસ કિસ્મ કે નામોં મેં ઐસી ના જાઈઝ તરમીમ હરગિઝ ન કી જાએ. ઈસી તરહ બહુત કસરત સે નામોં મેં તસ્ગીર (યા'ની છોટા કરને) કા રવાજ હૈ યા'ની નામ કો ઈસ તરહ બિગાડતે હૈં જિસ સે હકારત નિકલતી હૈ ઔર ઐસે નામોં મેં તસ્ગીર (યા'ની છોટાઈ) હરગિઝ ન કી જાએ લિહાઝા જહાં યેહ ગુમાન હો કે નામોં મેં તસ્ગીર કી જાએગી યેહ નામ ન રખે જાએં દૂસરે નામ રખે જાએં. (બહારે શરીઅત, જિ. 3, સ. 356) ❁ જો નામ બુરે હોં ઉન કો બદલ કર અચ્છા નામ રખના યાહિયે કે હુસ્ને અખ્લાક કે પૈકર, નબિયોં કે તાજવર, મહબૂબે રબ્બે અકબર صَلَّی اللہُ تَعَالٰی عَلَیْہِ وَاٰلِہٖ وَسَلَّم બુરે નામ કો (અચ્છે નામ સે) બદલ દિયા કરતો થો. (૨૪૬૮૧ હદિથ ૩૮૨૨ વ ૬૫૫) એક ખાતૂન કા નામ “આસિયા” (યા'ની ગુનહગાર) થા, હુઝૂરે પાક, સાહિબે લૌલાક, સય્યાહે અફલાક صَلَّی اللہُ تَعَالٰی عَلَیْہِ وَاٰلِہٖ وَسَلَّم ને ઉસ કે નામ કો બદલ કર જમીલા રખા (૨૧૩૯ હદિથ ૧૧૮૧) ❁ ઐસે નામ મન્અ હૈં જિન મેં અપને મુંહ સે

ફરમાને મુસ્તકા: صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ : જો મુઝ પર એક દુરુદ શરીફ પઢતા હૈ અલ્લાહ عزوجل उस के लिये ओक कीरात अजर लिખता है और कीरात उहुद पछाउ जितना है. (जि:५)

ખુદ કો અચ્છા બતાના યા'ની અપને “મુંહ મિયાં મિઠ્ઠૂ” બનના પાયા જાએ. પારહ 27 સૂ-રતુન્નજમ આયત નમ્બર 32 મેં ઇશદિ ઇલાહી જાએ : **فَلَا تَزِرُكُوا أَنْفُسَكُمْ** : “તો આપ અપની જાનોં કો સુથરા ન બતાઓ.” આ'લા હઝરત رَحْمَةُ اللهِ تَعَالَى عَلَيْهِ ने “હુસૂલે ઇમાદી” કે હવાલે સે લિખા હૈ : કોઈ उस नाम के साथ नाम न रखे जिस में तजकिया या'नी अपनी बडाई और ता'रीफ का ईजहार हो. (इतावा २-अविध्या, जि. 24, स. 684) मुस्लिम शरीफ में है : सरकारे मदीना صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ ने “बरह” (या'नी नेक बीबी) नामी औरत का नाम बदल कर “जैनब” रखा और इरमाया : “अपनी जनों को आप (या'नी खुद) अच्छा न बताओ. अल्लाह पूब जानता है के तुम में नेककार कौन है.” (मुस्लिम ११२ व ११३ हदित २१६२)

❁ जैसे नाम रखना जाईज नहीं जो कुर्फार के लिये मप्सूस हों. इतावा २-अविध्या जिल्द 24 सईहा 663 ता 664 पर है : नामों की ओक किस्म कुर्फार से मुप्तस (या'नी मप्सूस) है जैसे जिरजिस, पुतरुस और यूहन्ना वगैरा लिहाजा इस नौअ (या'नी किस्म) के नाम मुसल्मानों के लिये रखने जाईज नहीं क्यूंके इस में कुर्फार से मुशा-बहत पाई जाती है. ❁ وَالله تَعَالَى اعْلَم. गुलाम मुहम्मद और अहमद जिन नाम रखना जाईज है मगर बेहतर येही है के गुलाम या जिन वगैरा लफ्ज न बढाया जाओ. ता के मुहम्मद और अहमद नाम के जो इजाईल अहादीसे मुबा-रका में वारिद हें वोह हासिल हों. ❁ गुलामे रसूल, गुलामे सिद्दीक, गुलामे अली, गुलामे हुसैन, गुलाम गौस, गुलाम रजा नाम रखना जाईज है.

ફરમાને મુસ્તકા : صَلَّی اللہُ تَعَالٰی عَلَیْہِ وَاٰلِہٖ وَسَلَّمَ : जिस ने किताब में मुज़ पर दुइद पाक लिखा तो जब तक मेरा नाम उस में रहेगा फिरिश्ते उस के लिये छस्तिगकार करते रहेंगे. ﴿۱۱﴾

હઝારોં સુન્નતોં સીખને કે લિયે મક-ત-બતુલ મદીના કી મત્બૂઆ દો કુતુબ (1) 312 સફહાત પર મુશ્તમિલ કિતાબ “બહારે શરીઅત” હિસ્સા 16 ઔર (2) 120 સફહાત કી કિતાબ “સુન્નતોં ઔર આદાબ” હદિય્યતન હાસિલ કીજિયે ઔર પઢિયે. સુન્નતોં કી તરબિય્યત કા એક બેહતરીન ઝરીઆ દા’વતે ઈસ્લામી કે મ-દની કાફિલોં મેં આશિકાને રસૂલ કે સાથ સુન્નતોં ભરા સફર ભી હૈ.

લૂટને રહમતેં કાફિલે મેં યલો સીખને સુન્નતેં કાફિલે મેં યલો
હોંગી હલ મુશ્કિલેં કાફિલે મેં યલો ખત્મ હોં શામતેં કાફિલે મેં યલો

صَلُّوْا عَلَى الْحَبِيبِ ! صَلَّى اللهُ تَعَالَى عَلَى مُحَمَّدٍ

તાલિબે ગમે મદીના

વ બકીઅ વ મગ્ફિરત

વ બે હિસાબ જન્નતુલ

ફિરદોસ મેં આકા

કા પડોસ



6 રબીઉન્નૂર શરીફ 1433 હિ. 30-1-2012

યેહ રિસાલા પઠ કર દૂસરે કો દે દીજિયે

શાદી ગમી કી તકરીબાત, ઈજતિમાઆત, આ’રાસ ઔર જુલૂસે મીલાદ વગૈરા મેં મક-ત-બતુલ મદીના કે શાએઅ કર્દા રસાઈલ ઔર મ-દની ફૂલોં પર મુશ્તમિલ પેમ્ફલેટ તક્સીમ કર કે સવાબ કમાઈયે, ગાહકોં કો બ નિય્યતે સવાબ તોહફે મેં દેને કે લિયે અપની દુકાનોં પર ભી રસાઈલ રખને કા મા’મૂલ બનાઈયે, અખ્બાર ફરોશોં યા બચ્ચોં કે ઝરીએ અપને મહલ્લે કે ઘર ઘર મેં માહાના કમ અઝ કમ એક અદદ સુન્નતોં ભરા રિસાલા યા મ-દની ફૂલોં કા પેમ્ફલેટ પહોંચા કર નેકી કી દા’વત કી ધૂમેં મચાઈયે ઔર ખૂબ સવાબ કમાઈયે.

उ-वान	अंक	उ-वान	अंक	उ-वान	अंक
दुरुद शरीक की क्रीवत	1	दो अम्द पसन्द मुअज्जिनाओं की बरभादी	12	परहेज गार भी कंस जते हूँ	22
श्रुभाहीम जलीबुल्लाह के वतीजे	1	बेहरे का गोशत जड गया	13	अम्द के कितने से बथो	22
दुन्या में सभ से पहले शैतान ने बह के'वी करवाठी	2	शहवत से विभास देभना भी हराम	14	शहवत की पडवान	23
सय्यिदुना वूत ने समजया	2	भौकनाक सांप की जर्ब	15	शहवत से बथने के 12 म-दनी बूब	23
क्रीमे वूत पर दरजा भेज अजाब नाजिल हो गया	3	शहवत परस्ती के मुफ्तविक अन्दाज	15	भीऽ में किसी को भी घुसना नहीं चाहिये !	24
पथर ने पीछा डिया !	5	भोसा लेने का अजाब	16	श्रुभामे आ'जम का अम्द के बारे में तर्जें अमव	25
सुअर श्रुवाम बाज होता है	6	बद निगाही से शकव बिगड सकती है	17	अम्द की पडवान	26
अल्लुहाल ज़ुज़्ज़ु की बारगाह में सभ से जियादा	6	क़भ्र में कीड सभ से पहले तेरी आंभ भाअंगे	17	अम्द को तोहफा देना कैसा ?	27
ना पसन्दीदा गुनाह	6	नजर की छिफ़ाजत करने वाले के विये जहन्नम से	18	अम्द के विये अहलियात के 19 म-दनी बूब	28
तीन तरह के अम्द परस्त	7	अमान है	18	अम्द का ना'त शरीक पढना	31
सुवगती वार्श	7	श्रुव्हीस का जहरीवा तीर	18	हैंड प्रेक्टिस का अजाब	31
अम्द भी जहन्नम का छकदार !	8	अम्द के साथ तन्हाई सात दरिन्दों से भी जियादा	18	बरबाद जवानी	32
क्रीमे वूत के कब्रिस्तान में	8	भतरनाक	19	पैगामे हया	33
श्रुवाम बाज की दुन्या में सज्ज	8	अम्द औरत से भी जियादा भतरनाक है !	19	हैंड प्रेक्टिस की 26 जिस्मानी आकतें	34
बह के'वी को ज़र्रज समजना कैसा ?	9	अम्द के साथ 17 शयातीन	20	हैंड प्रेक्टिस करने वाला हर पांचवां कई पागल	35
"काश ! बह के'वी ज़र्रज होती" कइना कुकू है	9	अम्द "आग" है	20	श्रुस गुनाह से बथने के 5 वृत्तानी श्रुवाज	35
पेश श्रुभा की करामत	10	अम्द के साथ 70 शैतान	21	श्रुस गुनाह से बथने की 6 तदबीरें	36
हाकिजे की तवाही का अक सभभ	11	अम्द त्मा-जे को साथ ले कर न निकवो !	21	नाम रभने के बारे में 18 म-दनी बूब	39

ماخذ ومراجع

مطبوعه	کتاب	مطبوعه	کتاب
دارالکتب العلمیہ بیروت	الطیقات الکبریٰ لابن سعد	مکتبہ المدینہ باب المدینہ کراچی	قرآن پاک
دارالکتب العلمیہ بیروت	مکلفہ القلوب	دار احیاء التراث العربی بیروت	تفسیر روح البیان
دارالکتب العلمیہ بیروت	نزہۃ المجالس	دار الفکر بیروت	تفسیر الصاوی
مکتبہ المدینہ باب المدینہ کراچی	عجایب القرآن	پشاور	تفسیرات صحیحہ
کوئٹہ	المناقب للکفوری	مکتبہ المدینہ باب المدینہ کراچی	خزائن العرفان
دار المعرفہ بیروت	الروایح عن ائمتنا کبارنا	بیر بھائی اینڈ سنٹی	نور العرفان
دار المعرفہ بیروت	دینکار	دارالکتب العلمیہ بیروت	بیتاری
دار المعرفہ بیروت	تاریخ و مناقب لابن عساکر	دار ابن حزم بیروت	مسلم
دارالکتب العربیہ بیروت	حسیبہ العالین	دار احیاء التراث العربی بیروت	سُنن ابوداؤد
دار احیاء و التراث العربی بیروت	اروش القافی	دار الفکر بیروت	سُنن ترمذی
دار المعرفہ بیروت	روح البیان	دارالکتب العلمیہ بیروت	اسنن الکبریٰ للبخاری
دار المعرفہ بیروت	معروض	دار احیاء التراث العربی بیروت	مجموعہ کبیر
دار المعرفہ بیروت	فتاویٰ رضویہ	مؤسسہ الرسالہ بیروت	مشہد الصحاب
کوئٹہ	المحررات	دارالکتب العلمیہ بیروت	القرودین بما تروا نظاب
انتشارات تجلیہ بیروت	تذکرہ الاولیاء	مؤسسہ اکتب الثقافہ بیروت	الرحمہ العظیم
انتشارات تجلیہ بیروت	کیسائے سعادت	دارالکتب العلمیہ بیروت	شعب الایمان
مکتبہ المدینہ باب المدینہ کراچی	بہار بیوت	دارالکتب العلمیہ بیروت	منج الجوامع
مکتبہ المدینہ باب المدینہ کراچی	کفر کی گات کے بارے میں سوال جواب	دارالکتب العلمیہ بیروت	شذرات الذهب



الحمد لله رب العالمين والصلوة والسلام على سيد المرسلين انا بعد فاعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم

सुन्नत की बहारें

الحمد لله الذي جعلنا من عباده المخلصين الذين هم خير خلق الله اجمعين. सुन्नत की आलमगीर गैर सियासी तहरीक हा'वते ईस्लामी के मडके मडके म-दनी माडोल में अ कसरत सुन्नतों सीपी और सिभाई जती हैं, हर जुमा'रात ईशा की नमाज के बा'द आप के शहर में छोने वाले हा'वते ईस्लामी के छफ्तावार सुन्नतों भरे ईजतिमाअ में रिजाअे ईलाही के लिये अय्यी अय्यी नियतों के साथ सारी रात गुजारने की म-दनी ईल्तिज है. आशिकाने रसूल के म-दनी काफिलों में अ नियते सवाअ सुन्नतों की तरबियत के लिये सफर और रोजाना किंके मदीना के जरीअे म-दनी ईन्आमात का रितावा पुर कर के हर म-दनी माड के ईप्तिदाई दस दिन के अन्दर अन्दर अपने पहां के जिम्मेदार को जम्अ करवाने का मा'भूल बना लीजिये, **إِنَّ اللَّهَ مُرَجِّلٌ** ईस की अ-र-कत से पाबन्दे सुन्नत बनने, गुनाहों से नकरत करने और ईमान की छिकाजत के लिये कुठने का जेहूअ बननेगा.

हर ईस्लामी भाई अपना येह जेहूअ बनाअे के "मुजे अपनी और सारी दुन्या के लोगों की ईस्लाह की कोशिश करनी है. **إِنَّ اللَّهَ مُرَجِّلٌ**" अपनी ईस्लाह की कोशिश के लिये "म-दनी ईन्आमात" पर अमल और सारी दुन्या के लोगों की ईस्लाह की कोशिश के लिये "म-दनी काफिलों" में सफर करना है. **إِنَّ اللَّهَ مُرَجِّلٌ**

मड-त-अतुल मदीना की शाणें

- सुरत : वखियाभाई मस्जिद, प्वाज्र दाना दरगाह के पास. 98988615071
- जमनगर : पांच छाटडी, 9327977293
- भोडासा : सुका अज्जर, 9725824820
- गांधीधाम : सपना नगर, मदीना मस्जिद के पास, 8141474279
- धोलका : ताजदारे मदीना मस्जिद के सामने, टावर बाजार, 9374915797

मड-त-अतुल मदीना[®] مكتبة الدعوة

हा'वते ईस्लामी

सिलेक्टेड हाउस, अलिक की मस्जिद के सामने, टील दरवाजा, अहमदशाहाह-1 गुजरात, इंडिया
 Mo.091 93271 68200 E-mail:maktabahind@gmail.com, www.dawateislami.net